

Date: 5th September, 2023 The Manager BSE Limited 25th Floor, Phiroze Jeejabhoy Towers, Dalal Street Mumbai- 400001 SCRIP CODE: 540359

Sub.: Newspaper Advertisement- Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sirs,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper advertisement published in Financial Express (Ahmedabad Gujarati Edition) and Financial Express (Ahmedabad English Edition) dated 5th September, 2023 for convening the 29th Annual General Meeting of the Company to be held on 29th September, 2023.

Thanking you,

Yours Faithfully,

For Parmax Pharma Limited

Yash Vora

Company Secretary

Encl.: As above

GALAXY AGRICO EXPORTS LIMITED

REGD. OFF / Factory : Jaikishan Ind. Estate, Survey No. 236, B/H Murlidhar Weigh Bridge Veraval (Shapar). Dist. Rajkot. Tel. 02827-252676 Fax: 02827-254371 E-mail: info@galaxyagrico.com Web: www.galaxyagrico.com CIN: L01110GJ1994PLC021368

NOTICE OF AGM, E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that 29th Annual General Meeting (AGM) of Members of the Company will be held on Saturday, 30" September, 2023 at 11.00 a.m. At 236 Jai Kishan Industrial Estate, Behind Murlidhar Weigh Bridge, Veraval-Shapar (360024) Gujarat (India) to transact the ordinary and special businesses mentioned in the notice as contained in the Annual Report of the Company for the Financial Year 2022 - 23. Members of the Company are hereby informed that the Company has completed the dispatch of Notice of the AGM. As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and amendments thereto and Clause 35B of the Listing Agreement, the Company is pleased to provide its Members the facility to cast their vote electronically, through the remote e-voting services provided by Central Depositary Service Limited (CDSL), on all resolution set forth in the

The date of completion of dispatch of Notices is 05th September, 2023. The Company has sent e-mail through CDSL along with details of Login ID and Password to the Members whose e-mail ids are available with the Company or have been provided by the Depositories.

Pursuant to the 20 of the Companies (Management and Administration) Rules, 2014 and amendments thereto the Members are provided with the following Information:

1.The remote e-voting period commences on Wednesday 27th September, 2023 (9:00 a.m. IST) and ends or Friday 29th September, 2023 (5:00 p.m. IST). Remote e-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on 29th September, 2023. The voting rights of the members, entitled to participate in the remote e-voting process shall be in proportion to their share in the paid up equity share capital of the company as on the cut-off date i.e. Saturday, 23th September, 2023.

2.Any person, who acquires shares of the Company and become member of the company after dispatched of the notice and holding shares as of the cut-off date i.e. Saturday 23° September, 2023, may obtain the login ID and Password by sending a request at evoting@cdsl.co.in or RTA of the Company. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote.

3.The Members are also informed that:

a. The facility for voting through ballot paper shall be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to excersice their right at the meeting through ballot paper.

b. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again in the meeting.

c. A Member as on the cut-off date shall only be entitled for availing the Remote e-voting facility or vote, as the case may be, in the AGM.

d. A person, whose name is recorded in the register of the members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avial the facility of remote e voting / Voting at the AGM through ballot paper.

1. The Notice of the AGM, along with the procedure for remote e-voting, has been sent to all the members by prescribed modes and the same is also available on the website of the company at www.galaxyagrico.com and on the website of National Securities Depository Limited at https://www.evoting.cdsl.com 2.In case of queries/grievances connected with e-voting, Members/Beneficial owner may contact CDSL Mr. Nilesh Dalwadi, email: ahmedabad@linkintime.coin, Phone No.: (079) - 2646 5179. or Members may contact Mr. Manoj Shah (Whole time Director) at the Registed Office of the Company at Jai Kishan Industria Estate, Behind Murlidhar Weigh Bridge, Veraval-Shapar (360024) Gujarat (India) Phone : 02827-252676 email: mike@galaxyagrico.com

M/s H. B. Kalaria & Associates, Chartered Accountant, Rajkot has been appointed as Scrutinizer for conducting the remote e-voting process in a fair and transparent manner. Further notice is hereby given that pursuant to provisions of section 91 of the Companies Act. 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Clause 16 of the Listing Agreement, Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, September 23, 2023 to Saturday, September 30th, 2023 (Both days inclusive) for the said AGM of the Company.

A member entitled to attend and vote at the meeting is entitled to appoint proxy to attend and vote on a poll instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing proxy should however be deposited at the registered office of the company not less than forty-eight hours before the commencement of the meeting.

By Order of the Board, GALAXY AGRICO EXPORTS LIMITED

Date: 05-09-2023 Place: Rajkot

Sd/-Manoj Harsukhlal Shah WHOLE-TIME DIRECTOR DIN: 02173383

Essen Speciality Films Limited **ESSEN**

Regd. Office: Survey No. 192, Plot No. A, Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India Contact: +91 98253 12701 | E-mail: compliances@essenspeciality.com Website: www.essenspeciality.com | CIN: U24224GJ2002PLC041119

Notice of the 21st annual general meeting & E-voting information

NOTICE is hereby given that the 21st Annual General Meeting (AGM) of the Members of Essen Speciality Films Limited will be held on Friday, September 29, 2023 at 11:00 A.M. (IST) at Rajoo Avenue, Survey No. 210, Plot No.1, Industrial Area, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024 to transact the businesses as set out in the Notice of 21st AGM.

In compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with all applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI Circular"), the Company has sent the Notice of the 21st AGM along with its Annual Report for the Financial Year 2022-23 through electronic mode only, to those members whose e-mail addresses ar registered with the Company/Registrars and Transfer Agent/

The Annual Report of the Company for the Financial Year 2022-23, interalia, containing the Notice of the 21st AGM is available on the website of the Company i.e. www.essenspeciality.com, and also on the stock exchange website at www.nseindia.com. The Notice of 21st AGM is also available on the website of Biashare Services Private Limited at https://ivote.bigshareonline.com/.

Voting through electronic mode

Pursuant to the provisions of Section 108 of the Companies Act. 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015 (as amended), and the Circulars issued by the Ministry of Corporate Affairs (as may be notified from time to time) the Company is providing facility of remote e-Voting to its Members in respect of the business to be transacted at the 21st AGM. For this purpose, the Company has engaged Biashare Services Pvt. Ltd ("BIGSHARE") for facilitating remote e-voting to enable the Members to cast their votes electronically in respect of all the resolution as set out in the 21st AGM Notice. The EVSN (E-voting Sequence Number) is allotted to the Company by BIGSHARE is 99.

- The remote e-Voting period will begin on Tuesday, September 26. 2023 at 9.00 a.m. IST and will end on Thursday, September 28, 2023 at 5.00 p.m. IST. During this period, the shareholders of the Company as on the cut-off date i.e. September 22, 2023 may cast their vote electronically. The e-Votina module shall be disabled by Biashare for voting thereafter. Once vote is cast on a resolution, the members shall not be allowed to change subsequently.
- ii. The facility for voting will also be made available during the AGM and the members present in the AGM physically, who have not cast their vote their vote through remote e-voting through ballot paper during
- iii. The members who have cast their vote by remote e-voting may join the AGM but shall not be entitled to cast their vote again

For the process and manner of remote e-voting as well as voting through ballot paper during the AGM, member(s) may go through instructions stated in the Notice of AGM. In case of any queries regarding e-Voting, you may refer the Frequently Asked Questions (`FAQs') and i-Vote e-Voting module available at https://ivote.bigshareonline.com, under download section or you can email to ivote@bigshareonline.com or call at: 1800 22 54 22.

> For, Essen Speciality Films Limited (Formerly known as Essen Speciality Films Private Limited Pallav K. Doshi

Date:- September 05, 2023 Chairman & Wholetime Dir Place:- Veraval (Shapar)

PUBLIC NOTICE

General public is hereby informed that our client, M/s. Muthoot Finance Ltd. (GSTIN 32AABCT0343B1Z7), Registered Office: 2nd Floor, Muthoot Chambers, Banerji Road, Kochi-682018, Kerala, India, CIN: L65910KL1997PLC011300, Ph: +91 484-2396478, 2394712, Fax: +91 484-2396506 mails@muthootgroup.com, www.muthootfinance.com is conducting Auction of ornaments (Spurious/Low quality accounts for the period up to 31.03.2023), pledged in its favour, by the defaulting Borrowers, as detailed hereunder. All those interested may participate. First Auction Date: 19.09.2023

Spurious & Low Quality: Anjar: MUL-9862

Second Auction Date: 20.09.2023, Auction Centre: Plot No. 340, Sector 12/B, Firs Floor, Shop No. 4, Kailash Manas Complex, Gandhidham, Kutch-370201 First Auction Date: 19 09 2023

Spurious & Low Quality: Ahmedabad-Stadium Circle: MDL-918, MEG-54 Second Auction Date: 23.09.2023, Auction Centre: 203-204, Second Floor, Iskor Avenue, Opp. Choice Restaurant, C.G. Road, Ahmedabad, Gujarat-380009

First Auction Date: 19.09.2023 Spurious & Low Quality: Rajkot-Gondal Road: TMS-491, Rajkot-Trikon Baugh MDC-31, Gondal: MHP-263, Raikot-Pedak Road: MDL-4372. Jetpur: MUL-3500 Metoda: MSW-41

Second Auction Date: 23.09.2023, Auction Centre: Sugar House, First Floor Dheber Road, Near Trikonbaug, Rajkot, Gujarat-360001

The auctions in respect of the loan accounts shown under the branch head will be conducted at the respective branches.

However please note that in case the auction does not get completed on the given date(s), then in that event the auction in respect thereto shall be conducted/continued on Second Auction date at given auction centre, and further in case the said ornaments are still not successfully auctioned on these dates then such auction shall be continued on subsequent days thereafter, at this same venue. No further notices shall be issued in this respect.

Kohli & Sobti, Advocates, A 59A, First Floor, Lajpat Nagar-II, New Delhi - 110024 Note: Customers can release their pledged ornaments before the scheduled auction date, against payment of dues of our client. Customer can also contact Email ID recoverynorth@muthootgroup.com or Call at 7834886464,7994452461.



kotak

Regional Office: Kotak Mahindra Bank Ltd. 223-229 Siddhivinayak Complex, Shivranjini, Satelliit a Bank Ahmedabad-380015.

POSSESSION NOTICE (For imm (As per Appendix IV read with Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002) WHEREAS

The undersigned being the Authorized Officer of KOTAK MAHINDRA BANK LIMITED, a banking company within the meaning of the Banking Regulation Act 1949 having it's Registered Office at 27BKC, C 27, G Block, Bandra Kurla Complex Bandra (E). Mumbai - 400 051 and branch office situated at Raikot, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a **demand notice** dated 13.01.2023 calling upon the Borrower Borrower 1) M/s AyudhImpex Pvt Ltd (Borrower) 2) Alpesh Raviibhai Moradiya (Director / Mortgagor / Guarantor) 3 Sureshbhai Ravjibhai Moradiya (Director / Guarantor) 4) Kailashben S Moradiya (Guarantor) 5) Bhavdipkumar Arunbhai Dave (Mortgagor) 6) Gayatridev Ashokbhai Gadhvi (Guarantor) 7) Chetanbhai Arunbhai Dave (Guarantor Mortgagor) to repay the amount mentioned in the notice being aggregating Rs. 1,66,12,404.12/- (Rupees One Crore Sixty Six Lakh Twelve Thousand Four indred Four and Twelve Paisa Only)as on 05-01-2023, within 60 days from the late of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the prrowers and the public in general that the undersigned has taken **Physical** Possession of the property described herein below in exercise of powers conferred n him under Section 13 (4) of the said Act read with Rule 9 of the said rules on this 03.09.2023.

The Borrowers mentioned hereinabove in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the KOTAK MAHINDRA BANK LIMITED, for an amount of aggregating Rs. 1,66,12,404.12/- (Rupees One Crore Sixty Six Lakh Twelve Thousand Four Hundred Four and Twelve Paisa Only)as on 05-01-2023, along with future interest at the contractual rate and substitute interest, incidenta expenses, costs and charges etc. due from 06.01.2023 till the date of full repaymen and/or realization. Further the borrower's attention is invited to provisions of subsection (8) of section 13 of the Act, in respect of time available, to redeem the

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY ece and parcel of immovable property Plot No.11/A land admeasuring about 167.22 Sq. Mtrs together with superstructure constructed thereon both present and uture bearing Vadva Revenue Survey No.252 Paiki Situated at Laxminarayan Society Nr. Gauri Shankar Lake, Nr Bal-Vatiká, Village Vadva, Taluka and District Bhavanagr in the state of Gujarat and bounded as under : - East: Adj. Plot No.10, West: Adj. Plot

No.11/B, North: Open Land of Survey No.252 Paiki, South: Adj. Plot No.15. Date: 03.09.2023 Authorised Officer, Kotak Mahindra Bank Limited

Parmax Pharma Limited HARMALTD. (CIN: L24231GJ1994PLC023504)

Registered Office: Plot No. 20, Survey No. 52, Rajkot-Gondal National Highway No.27, Hadamtala, Raikot -360311 GJ, IN.

NOTICE FOR 29[™] ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

NOTICE is hereby given that the 29th Annual General Meeting (AGM) of the Members of Parmax Pharma Limited ('the Company') will be held on Friday, 29th September, 2023 at 3.00 p.m. at registered office of the company at Plot No. 20, Survey No. 52, Rajkot-Gondal National Highway No. 27, Hadamtala, Rajkot-360311, Gujarat, India to transact the business as set out in the Notice approved in Board Meeting dated 14th August, 2023 convening the AGM.

The Notice of the 29th AGM and Annual Report for the financial year 2022-23 have been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company/Depository Participants. Members desiring to receive the said documents in physical form will continue to get the same in physical form free of cost upon request.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 23rd September, 2023 to 29th September, 2023 (both days inclusive), for the purpose of the above referred 29th Annual General Meeting of the Company.

Any Person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM on 4th September, 2023 and holding shares as on the cut-off date i.e. on 22nd September, 2023 may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules. 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' (i.e. e-voting from a place other than venue of AGM) on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given here under: 1) Date of completion of dispatch of Notice AGM: 4th September,

2023 2) Date & Time of commencement of Remote e-voting: 09.00

a.m. on 26th September, 2023

3) Date & Time of end of Remote e-voting: 5.00 p.m. on 28th September, 2023

4) Cut-off date for determining rights of entitlement of Remote evoting: 22nd September, 2023

5) Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM.

6) Remote e-voting shall not be allowed beyond: After 5.00 p.m. on 28th September, 2023

7) Manner of casting vote on resolutions at the venue of AGM: The facility of voting through 'Ballot Paper shall be made available at the venue of AGM. E-voting facility will not be made available at the venue of AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again at AGM.

8) Notice of 29th Annual Report is available on Company's website & on CDSL website: www.parmaxpharma.com & www.evotingindia.com

9) In case of any queries or issues regarding e-Voting, shareholders may refer the Frequently Asked Questions "FAQs") and e-Voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

Place : - Hadmtala Date : - 4th September 2023 By Order of the Board For Parmax Pharma Limited sd/-

Mr. Umang Gosalia **Manging Director** Din No.: 05153830



Registered Office: 301-306, 3rd Floor, ABHIJEET -V. Opp. Mayor's Bungalow, Law Garden Road, Mithakhali Ahmedabad - 380006, Gujarat. www.fincarebank.com

The below mentioned borrower/s have been issued notices to pay their outstanding amounts towards the loan against gold facilities availed from Fincare Small Finance Bank Ltd ("Bank"). Since the borrower/s has/have failed to repay his/their dues, we are constrained to conduct an auction of pledged gold items/articles on 11 September 2023 between 11:00 AM - 03:00 PM (Time) at below mentioned branches according to the mode specified therein. In case of deceased porrowers, all conditions will be applicable to legal heirs. Please note that in the event of failure of the above auction, the bank reserves its right to conduct another auction without prior intimation.

E-Auction Branch Details (E-auction will be conducted by using Weblinkhttps://egold.auctiontiger.net/)

AHMEDABAD- PRAHLADNAGAR - 22660001235742, 23660000459395 ANAND - NEAR TOWN HALL - 23660000092534, 23660000139128 23660000293066, 23660000338283, 23660000338323, 23660000693663 23660000694072, 23660000727832, 23660000735836, 23660000738211 23660000738291 | **Ankleshwar -** 23660000090098. 23660000097045 23660000207161, 23660000262475, 23660000305816, 23660000325748 23660000351218, 23660000737273, 23660000800874 | **BALASINOR** 22660001217256, 23660000019644, 23660000117130, 23660000143700, 23660000222352, 23660000333263, 23660000338703, 23660000754180 BARODA - ALKAPURI - 22660001208513, 22660001242568, 22660001251471, 22660001277652, 22660001344146, 23660000140245 23660000255889, 23660000475024 | BARODA - KARELIBAGH 22660001179876, 23660000193664, 23660000214687, 23660000718539 23660000744759, 23660001089633 | **BAYAD -** 22660001051327 22660001130469, 22660001130859, 22660001188149, 22660001206527 22660001208933, 22660001209302, 22660001210569, 22660001210879 22660001211207, 22660001214722, 22660001266032, 23660000095069 23660000128469, 23660000230786, 23660000234419, 23660000282737, 23660000283195, 23660000283625, 23660000306554, 23660000342335 23660000349143 | **Bharuch - Shevashram Road -** 22660001183118, 22660001197352, 22660001210559, 23660000052021, 23660000071284, 23660000214567, 23660000426378, 23660000481553, 23660000495196 23660000560344 | **BODELI** - 23660000109965, 23660000316485 23660000317293, 23660000317903, 23660000691687 | **BOSAD - ANAND** CHOWKDI - 23660000162123, 23660000255639, 23660000347446 **CHHOTAUDEPUR** - 23660000624585 | **CHIKHLI** - 23660000356279 DAHEGAM - 23660000094031, 23660000094171, 23660000117650, 23660000214177, 23660000260009, 23660000314959, 23660000351528 23660000494508, 23660000494758, 23660000494908, 23660000759381 **DAHOD** - 22660001191622, 22660001258318, 22660001272791 23660000493300, 23660000509443, 23660000509953, 23660000554746 23660000645815 | **DEESA** - 23660000311244 | **DHOLKA** - 23660000728530 GANDHINAGAR SECTOR16 - 23660000057332, 23660000254681 | GODHRA 23660000301263 | **Jamnagar - Lal Bunglow Road -** 22660001127985 23660000275091, 23660000311534, 23660000318162, 23660000359153, 23660000640554, 23660000728880 | JHALOD-MUVADA BUS STOP 22660001075632 | JUNAGADH - ZAANZARDA ROAD - 23660000342845, 23660000344202 | KALOL - BT MALL - 22660001210959 | KARJAN -22660001067407, 23660000097245, 23660000321155 | **KHAMBHAT** 23660000359603 | **LIMBDI -** 22660001228345, 22660001301898, 23660000210304 | **LUNAVADA -** 23660000298307, 23660000345730 | MAHEMDAVAD - 23660000292238 | MEGHRAJ - 23660000079990 23660000162613, 23660000176757, 23660000322373, 23660000349863, 23660000356739 | **MEHSANA -** 22660001074733, 22660001339776 MEHSANA - ORBIT MALL - 23660000294044, 23660000515681 | MODASA - 22660001067167, 22660001151059, 22660001151529, 22660001151859, 22660001164744, 22660001173277, 22660001201986, 22660001208213 22660001258188, 22660001262550, 23660000133989, 23660000228821 23660000237913, 23660000281849, 23660000287288, 23660000318882 23660000375753, 23660000542589 | NADIAD - PARAS CIRCLE -23660000349543 | NARODA - 23660000445382 | NAVSARI - SAYAJI ROAD 22660001424096, 23660000491353, 23660000660866 | PALANPUR -23660000039926 | **RAJKOT** - 23660000319950, 23660000337995 23660000679241 | **SHEHERA -** 22660001106665, 22660001240162 23660000059948, 23660000235877 | **Surat - Adajan -** 22660001096642 22660001219862, 23660000089411, 23660000136333, 23660000339102, 23660000427906. 23660000754040 | **SURAT - KATARGAM** 22660001087539, 22660001099986, 22660001192551, 22660001198750 22660001202494, 22660001238556, 23660000052091, 23660000138160, 23660000338733, 23660000529114, 23660000650985, 23660000652482, 23660000769272, 23660000769302 | **TALOD** - 22660001196133, 23660000204056, 2366000400597 | **TARAPUR** - 22660001339166, 22660001375237, 23660000055935, 23660000223290, 23660000253983 23660000291290, 23660000326666, 23660000345510, 23660000624575 UDALPUR - 22660001044981 | UMRETH - 23660000154789 23660000162553, 23660000603245 | **VADODARA** - 23660000263173 23660000264082, 23660000287698, 23660000608986, 23660000730245 23660000757364 | VALLABH VIDYA NAGAR SFB - 22660001047635 22660001047945, 22660001423748, 23660000142862, 23660000234099 VAPI - VAPI DAMAN MAIN ROAD - 23660000111871, 23660000233271 23660000253633, 23660000353424, 23660000469666, 23660000511078 23660000631432 | **VIJAPUR -** 23660000305096.

Note: The auction is subject to certain terms and conditions mentioned in the bid form which is made available before the commencement of auction

> Manager Fincare Small Finance Bank

THE BARODA RAYON CORPORATION LIMITED

CIN -L45100GJ1958PLC000892

Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555 Email - admin@brcl.in, brcsurat@gmail.com Website-www.brcl.in **NOTICE OF 63rd AGM**

NOTICE is hereby given that 63rd ANNUAL GENERAL MEETING of the Company will be held on Thursday, the 28th September, 2023 at 09.00 a.m. at Patidar Bhavan, Kadodara, Surat - 394327 to transact the business as set out in the Notice of the 63rdAGM.

BOOK CLOSURE NOTICE AND E-VOTING

All the shareholders of the company are informed that the member's register of the company will be closed from Friday, 22nd September, 2023 to Thursday 28th September, 2023 (both day inclusive) for the purpose of AGM The Cut-off date for providing E-voting is Thursday, 21st September, 2023. All the members are hereby informed that:

1. Electronic copies of the Notice of AGM have been sent to all the members whose email IDs are registered with the Company/ Depository Participant(s). The same is available on Company's website www.brcl.in. The dispatches of Notice of AGM have been completed. 2. Members holding shares either in physical form or in dematerialized

form, as on the cut-off date of Thursday, 21st September, 2023, may cast their vote electronically on the business set out in the Notice of AGM through electronic voting system of NSDL from a place other than the venue of AGM ("remote e-voting"). All the members are informed that:

i. The Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means;

ii. The remote e-voting shall commence on Monday, 25th September, 2023 at 09.00 a.m. (IST); iii. The remote e-voting shall end on Wednesday, 27th September, 2023 at

05.00 p.m. (IST); iv. The cut-off date for determining the eligibility to vote by electronic means

at the AGM is Thursday, 21st September, 2023. v. Any person, who acquires shares of the company and become member of the company after the dispatch of the notice of AGM and holding shares as of the cut-off date i.e. Thursday, 21st September, 2023 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for e-voting then existing user ID and

password can be used for casting vote; vi. Members may note that: (a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility for voting through ballot paper shall be made available at the AGM; (c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and (d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility

of e-voting as well as voting at the AGM through ballot paper; vii. In case of any queries or issue regarding e-voting, you can write an email to evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 For The Baroda Rayon Corporation Limited

Kunjal Desai Place : Surat. **Company Secretary** Date: 04-09-2023

JANA SMALL FINANCE BANK

Head Office: The Fairway, Ground & First Floor, Survey No.: 10/1, 11/2 & 12/2B, Off Domlur, Koramangla Inner Ring Road, Next to EGL Business Park, Challaghatta, Bangalore-560071.

UBLIC NOTICE FOR AUCTION OF GOLD ORNAMENTS

The below mentioned borrowers have failed to repay the loan and redeem the gold rnaments within the stipulated time in spite of several reminders. The Gold ewellery/ornaments pledged under the said loan accounts by the below listed orrowers will be sold in public/ Online/ private auction at our Branch premises or 11-09-2023 at 10.30 AM. Those willing to participate are requested to contact the branch. The Bank reserves the right to accept or reject any bid without assigning any reason whatsoever. Please note if the auction does not get completed on the same day, the same will follow the subsequent days on the same terms and conditions. It the customer is deceased all the conditions pertaining to auction will be applicable to nominee/legal heir. The Borrower are hereby notified to pay the upto date interest and ancillary expenses before the date of auction, failing which the pledged gold ornaments will be sold and balance dues if any will be recovered with interest and cost. For any queries and terms and conditions contact branch. For details of branch address visit www.ianabank.com

Sr. No.	Loan Account No.	Name of Borrower/Co-Borrower	Gross Weight of Pledged Gold Ornaments				
1	30748730005281	Solanki	7.3				
Jana Small Finance Bank Ltd., Ridhdhi Siddhi Complex, 101-102, 1st Floor, Mahila Collage Road, Opp. Stri Vikas Gruh, Patel Colony, Jamnagar, Gujarat-361008.							
2	30978740000430	Janakben Thakor	24.59				
Jana Small Finance Bank Ltd., Ground Shop No.2/A and First Floor, Shop No.F.F.(2/A) Satved Complex", Near Sardar Patel Statue, Sardar Patel Road, Navrangpura, Ahmedabad-380013.							
3	31478730003399	Prajapati Umiyaben	7.5				
Jana Small Finance Bank Ltd., Shop No.102, 103, Navjeevan Complex, Mali Road, Kalol, Gandhinagar Dist. Ahmedabad, Gujarat State-382721.							
4	31528730001883	Chudasama Navinbhai	7.73				
Jana Small Finance Bank Ltd., 2nd Floor, Shop No.203 & 204, Prisam Complex, S.T. Road, Junagadh, Pin-362001.							
5	31798160000071	Vishalkumar Chauhan	8.22				
Jana Small Finance Bank Ltd., 2nd Floor, Ratan Sagar Complex, C/o. Hotel Sinlight, Nr Sahakari Jin Char Rasta, Himmatnagar-383001.							
6	31968730010544	Thakor Vishnuji	32.47				
Jana Small Finance Bank Ltd., GPP Square, Shop No.1 & 2, Ground Floor & First Floor, 101 & 102, Near Pashabhai Bharat Petroleum, National Highway, Nagalpur, Mehsana, Gujarat-384002.							

7 32408730001902 Patelkokilaben Pravinbhai Jana Small Finance Bank Ltd., Plot No. Shop No.1 Besides Vinay Medical, Halar Road, Valsad-396001, Gujarat

10.8 8 33028730014156 Nikunibhai Beldar 9 33028730014169 Nikunjkumar Beldar 25.28 10 33028730014297 Pathan Tanveer 8.425 Jana Small Finance Bank Ltd., 21-23 Rudra Green Complex, Above Canara Bank, Near Old Narol Court, Narol. 11 | 33368730018392 | Yadav Sureshkumar 3.78

Jana Small Finance Bank Ltd., Branch Office, 101/102 Ganesh Plaza, Near Ajit Mill Cross Road, Rakhial, Ahmedabad-380023 12 33468740000304 Pradhyumanbalvntsinh Vala Jana Small Finance Bank Ltd., 1st Floor, Shop No.115 & 116,

Advance Business Plaza, Near Namaskar Circle, Opp. Swami Narayan Temple, Shahibaug, Ahmedabad, Pin-380004, India. 13 33548730015560 Narendrabhai Pagi 7.82 14 33548730015623 Tushar Naydu

8.9 Jana Small Finance Bank Ltd., Shop No.1, Tower A Siganate Plaza, Kunal Char Rasta, Gotri Road, Vadodara-390021. 15 33998730015020 Parmar Mehul

Jana Small Finance Bank Ltd., Ground Floor, Survrey No.421, Opp. Ved Bunglows Airport Road, Nan Chiloda, Ahmedabad, Gujarat-382361 16 45168740000226 Zala Shailendrasinhvanrajsinh 28.64 17 | 45168740000315 | Shah Minaben 49.2 Jana Small Finance Bank Ltd., 1st Floor, 101 Sigma Arcade, Above Vijay

Sales, New Visat Petrol Pump, Chandkheda, Ahmedabad-382424. 18 | 45198730006119 | Rathod Hareshbhai 9.98 Jana Small Finance Bank Ltd., Ground Floor, No.4 & 1st Floor No.113, Sapphire Elegance, Sant Kanwar Ram Chowk,

Waghawadi Road, Bhavnagar-364001, India. 19 | 45228730002891 | Thoriya Jentibhai Jana Small Finance Bank Ltd., Business Avenue, 1st Floor, Nr KKV Circle,

Kalawad Road, Above Reebok Showroom, Rajkot-360005. 20 46368730002441 Miteshbhai Patel Jana Small Finance Bank Ltd., Ground Floor, No.UG 1, 2, 3 & LG 1, 2, 3, National Highway No.6, Surat Dhulia Road, Opp. Manik Moti Complex, Bardoli-394601, Gujarat India.

21 48368730002586 Kanuji Dabhi Jana Small Finance Bank Ltd., Ground Floor, Shop No.3, Plot No.1, Galaxy-2 Complex, Near Sabarkantha Bank, Railway Station Road, Mouje Vadali, Tal. Vadali, Dist. Sabarkantha, Pin Code-383235.

Sd/- Authorised Officer Date: 05.09.2023 Jana Small Finance Bank Limited



SHAREHOLDERS. VOTING AND BOOK CLOSURE Pursuant to the provision of Companies Act, 2013 ("ACT") and rules framed there under and the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 ["SEBI (LODR) Regulations], The Notice is hereby given that fourteen Annual General Meeting ("AGM") of the Shareholders of the company will be held on Tuesday, 26th September, 2023 at 01:00 P.M.(IST) at 32, Heera Panna Market, Pur Road, Bhilwara-311001 Rajasthan (India)

at 01:00 P.M.(IST) at 32, Heera Panna Market, Pur Road, Bhilwara-311001 Rajasthan (India) with presence of physical quorum to transact the business as set out in the notice of the Annual General Meeting (AGM).

The Notice convening AGM along with Annual Report of the company has been sent through electronic mode on 04th September, 2023 to all shareholders of the company whose Email Addresses were registered with Company/ Depository Participants. The Copy of Annual Report along with copy of Notice is also available on the Company's website http://manomaytexindia.com/annual_report.html, https://www.bseindia.com//,

https://www.nseindia.com/
The Board of Directors has appointed Mr. R.K. Jain of M/s. R. K. Jain & Associates
Practicing Company Secretary as the scrutinizer for the conduct of the voting process in a

fair and transparent manner.

NOTICE IS FURTHER given Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and regulation 42 of SEBI (Listing obligation and disclosure requirement), the register of members and the share transfer books of the Company will remain closed from 20th September 2023 to 26th September 2023 (both days inclusive). The Company has fixed the 19th September 2023 as the Record date/cut-off date for the purpose of determining members eligible for voting in the ensuing Annual General Meeting.

For any grievance/ queries members are requested to contact Mr. Kamesh Shri Shri Mal, Company Secretary, Manomay Tex India Limited at Registered Office: 32, Heera Panna Market, Pur Road, Bhilwara, Rajasthan 311001 India. Email: cs@manomaytexindia.com, Tel: 01482-246983.

For: Manomay Tex India Limited

Date: 04-09-2023 Place: Bhilwara (Raj.) India (Kamesh Shri Shri Mal) Company Secretary

HRIDAY CREDIT CO-OPERATIVE SOCIETY LIMITED, UDAIPUR **NOTICE: ANNUAL GENERAL MEETING**

Notice is hereby given that 16th Annual General Meeting of the Hriday Credit Cooperative Society Limited will be held on Saturday, 23rd September, 2023 at 03:00 P.M. at Hotel Harku Villa, Airport Road, National Highway 76 Udaipu Rajasthan 313022 to transact the following business concerning the society

AGENDA

- To grant leave of absence to those r nbers of the society who have not attended the General Meeting.
- To Read and confirm the Minutes of Last Annual General Meeting.

4. To Appropriate Net Profit for the year ended 31st March 2023.

- 3. To approve Annual Report and Audited Statement of Accounts for the year ended 31st March 2023.
- 5. To Approve proposed Annual Budget for Income and Expenditure for F.Y. 2023-2024. 6. To Appoint Statutory Auditor and fix its remuneration for the F.Y. 2023-2024.
- 7. List of employees who are relatives of members of the board or of the Chief Executive 8. Disposal of any other business with the permission of Chairman.

Place: Udaiour Date: 02nd September, 2023

For: Hriday Credit Co-operative Society Ltd. By order of the Board of Directors Raiesh Jain

Note for Member's Attention:

- 1. If there is no quorum for the meeting at the appointed time, in terms of Bye-Laws no. 31, the meeting shall stand adjourned to 04:00 P.M on the same day and the Agenda of the Meeting shall be transacted at the same venue irrespective of the Rules of Quorum.
- 2. Anyone who desires to move any resolution may please send the same in duplicate on or before 18th September, 2023 by 04:00 P.M at the Head Office of the society
- 3. Any Query pertaining to accounts may please be sent to the office of the society at least four working days before the date of Annual General Meeting

Member's Identity Card is must for the attendance in Annual General Meeting

KAIZEN AGRO INFRABUILD LIMITED

(Formerly: Anubhav Infrastructure Limited) CIN: L51109WB2006PLC107433 Regd. Office: Chatterjee International Centre, 33A, Chowringhee Road 6th Floor, Room No. 6A, Russel Street Kolkata-700 071

Phone: 82320 13440, E-mail: info@anubhavinfrastructure.com

Website: www.anubhavinfrastructure.com

NOTICE

NOTICE is hereby given that the 18th Annual General Meeting (AGM) of the Members of Anubhav Infrastructure Limited will be held on Saturday, the 30th day of September, 2023 at 10.00 A.M. at "Diamond Plaza, 5 Gopi Ghosh Lane, Kolkata-700 012" to transact the Ordinary and Special Business as set out in the Notice date

August 19, 2023.

Notice convening the AGM setting out the business as set out in the Notice dated August 19, 2023.

Notice convening the AGM setting out the business to be transacted at the Meeting along with the Explanatory Statement, Financial Statement, Attendance Slip, Proxy Form and the Circular for Voting through electronic means will be sent to the Members. The Company has also uploaded these documents on the website of the Company at www.anubhavinfrastructure.com.

www.anubnavinrastructure.com.
Further, Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013
read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014
and Regulation 42 of SEBI (Listing Obligations & Disclosure Requirements)
Regulations, 2015 that the Register of Members and the Share Transfer Books of the
Company will remain closed from 25th September, 2023 to 30th September, 2023

(both days inclusive) for the purpose of the AGM of the Company.

Members are advised that the business at the AGM may be transacted through Evoting. The E-voting period commences on 27th September, 2023 at 9.00 A.M and
ends on 29th September, 2023 at 5.00 P.M. The E-voting shall not be allowed beyond the said date and time. During this period the members of the Company holding shares either in physical form or in dematerialized form as on the cut-off date (record date) i.e. 23rd September, 2023 may cast their vote electronically.

The shareholders attending the meeting physically or through proxy may cast their

vote through ballot at the venue of the meeting. However, in case of vote already

casted through remote e-voting, any further voting at venue through ballot shall be treated as invalid and voting through remote e-voting shall prevail. M/s. Kalpana Tekriwal & Associates, Practicing Company Secretary, Kolkata has been appointed as the Scrutinizer for the e-voting and voting by ballot process in a fair and

transparent manner. For any grievance in the matter of e-voting, the undersigned may be contacted by e-mail at info@anubhavinfrastructure.comor over phone at 91. 82320 13440.

By Order of the Board For Anubhay Infrastructure Limited

Place : Kolkata

Date : September 04, 2023

Nikita Rateria (Company Secretary) Memb No. 36115

श्रेनो सिभिटेड

CIN: U26100GJ1944PLC000345 **રજીસ્ટર્ડ ઓફિસઃ** એલેમ્બિક રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૩ होनः +८१ २९५ ९९३७३०० ย-भे**ต:** shreno.investors@alembic.co.in

नोटीस

આથી નોટીસ આપવામાં આવે છે કે, કંપનીના સભ્યોની **૭૮મી વાર્ષિક સામાન્ય** સભા (એજીએમ) શુક્રવાર, તા. રહ્મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૪:૦૦ કલાકે એજીએમની નોટીસમાં જણાવ્યા મુજબના વ્યવસાયોના વ્યવહાર માટે કંપની ધારા ૨૦૧૩ (''ધારા'')ની લાગુ પડતી જોગવાઈઓ અનુસાર અને મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સ ("MCA") દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવેલ વિવિધ પરિપત્રો क्षारा निर्धारित प्रिक्वाना पासन અन्पर्थे पिडियो डोन्डरन्सिंग ("VC") / अन्य ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ ("OAVM") દ્વારા યોજાશે.

એજીએમની નોટીસ સહિતનો વાર્ષિક અહેવાલ જેમાં VC/OAVM દ્વારા એજીએમ માં જોડાવવા તથા ઇ-વોર્ટિંગ કરવાની પ્રક્રિયા અને પદ્ધતિનો સમાવેશ છે તે **૪થી સપ્ટેમ્બર, ૨૦૨૩** ના રોજ ફક્ત તે જ સભ્યોને મોકલવામાં આવ્યા છે. જેમના ઇ-મેલ એડ્રેસ કંપની/ડિપોઝીટરીઝમાં નોંધાચેલા છે. વાર્ષિક અહેવાલ નીચે દર્શાવેલ વેબલિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

https://www.evoting.nsdl.com/

નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("NSDL") ની ઇ-વોર્ટિંગ સેવાઓ દ્વારા ร่นคी तेना ઇક्વिटी शेरधारडोने ઈલેક્ટ્રोनिકली भतदान (''रीभोट ઇ-વોર્ટિગ'' કરવાની સવિધા આપતા આનંદ અનભવે છે.

કલમ ૪७ની જોગવાઈઓ અને ધારાની અન્ય લાગુ પડતી જોગવાઈઓ અનુસાર ७% નોન-કન્વર્ટિબલ ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેકરન્સ શેર્સ ("7% NCRPS") ધરાવનાર કંપનીના સભ્યોને એજીએમમાં મત આપવાનો કોઇ અધિકાર નથી. જો કે, તેઓ એજીએમ ની નોટીસમાં આપેલી પ્રક્રિયાને અનુસરીને VC/OAVM દ્વારા એજીએમમાં

રિમોટ ઇ-વોર્ટિંગ (એજીએમના સ્થળ સિવાયના સ્થળેથી ઇ-વોર્ટિંગ) ની અવધિ મંગળવાર, તા. રકમી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શરૂ થશે અને ગુરૂવાર, તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ કલાકે સમાપ્ત થશે. આ સમયગાળા દરમ્યાન **શુક્રવાર, તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩** ની કટ ઓફ તારીખ પ્રમાણે ઈક્વિટી શેર ધરાવતા કંપનીના સભ્યો પોતાનો મત ઈલેક્ટ્રોનિકલી આપી શકે છે. ત્યારબાદ રિમોટ ઇ-વોર્ટિંગ મોક્યુલ NSDL દ્વારા બંધ કરવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વોર્ટિંગ સિસ્ટમ (''ઇ-વોર્ટિંગ'') માટેની સુવિધા એજીએમમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એજીએમમાં હાજરી આપતા ઇક્વિટી શેરઘારકો, જેમણે રિમોટ ઇ-વોર્ટિંગ દ્વારા તેમના મત આપ્યા નથી તેઓ એજીએમમાં તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકશે. જે ઇક્વિટી શેરધારકોએ એજીએમ પહેલા રિમોટ ઇ-વોર્ટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે, તેઓ VC/OAVM દ્વારા એજીએમમાં હાજરી/ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ ફરીથી પોતાનો મત આપવા માટે હક્કદાર રહેશે નહિં. રિમોટ ઇ-વોર્ટિંગ અને એજીએમ દરમ્યાન ઇ-વોર્ટિંગ કરવા માટેની વિગતવાર

કોઈપણ સભ્ય ફીઝીકલ સ્વરૂપે શેર્સ ધરાવતા હોય અને બિન-વ્યક્તિગત શેર હોલ્ડર્સ, જેઓએ કંપનીના શેર્સ ખરીધ્યા હોય અને જે કંપનીના સભ્ય નોટીસ મોકલ્યા પછી બન્યા હોય અને કટ-ઓફ તારીખે શેર્સ ધરાવતા હોય તેઓ evoting@nsdl.co.in પર વિનંતી કરી User ID અને Password મેળવી શકે છે. જો કે, જો તેં/તેણી પહેલાથી જ રિમોટ ઇ-વોર્ટિંગ માટે NSDL સાથે રજીસ્ટર થચેલ હોય તો તે/તેણી તેઓના હાલના User ID અને Password નો ઉપયોગ મત આપવા માટે કરી શકે છે.

પ્રક્રિયા એજીએમની નોટીસમાં આપવામાં આવી છે.

સ્થળ ઃ વડોદરા

તારીખ: ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૩


રિમોટ ઇ-વોર્ટિંગ અંગે અથવા એજીએમમાં હાજરી આપવા અંગેના પ્રક્ષો અથવા સમસ્યાઓ હોય તો, કૃપા કરીને પલ્લવી મ્હાત્રે, સિનિયર મેનેજર, NSDL, ચોથો માળ, એ-વિંગ ટ્રેક વર્લ્ડ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩, ઇ-મેલઃ evoting@nsdl.co.in, ટેલિ. ૦૨૨-૪૮૮૬७૦૦૦ અને ૦૨૨-૨૪૯૯૭૦૦૦ નો સંપર્ક કરવો.

> શ્રેનો લિમિટેડ વતી, સહી / -

Date: September 5, 2023

સંકલ્પ પંચાલ કંપની સેક્રેટરી

ચાર્ટર્ડ લોજિસ્ટિક લિમિટેડ



ઇમેઇલઃ cs@chartered.co.in, વેબસાઇટઃ www.chartered.co.in ર૮મી વાર્ષિક સાધારણ સભા, રિમોટ ઇ-વોટીંગની માહિતી અને બુક બંધ ની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે ચાર્ટર્ડ લોજિસ્ટીક્સ લિમિટેડની (૨૮મી) **અઠ્યાવીસમી વાર્ષિક સાધારણ સભા** (એજીએમ) ગુરૂવાર, તા. સપ્ટેમ્બર ૨૮,૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે અમારી કંપનીની રજીસ્ટર્ડ ઓફિસઃ **બી-૫૦૧, સ્ટેલર, અરિસ્તા સામે, સિંઘુ ભવન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૯**, ખાતે સભાની નોટિસમાં જણાવ્યા અનુસાર કામકાજ હાથ ધરવા બાબતે યોજાશે.

જે શેરધારકોનાં ઇ-મેઇલ આઇડી રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ / ડિપોઝીટરી સહભાગી(ઓ) સાથે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રજિસ્ટર્ડ છે, એ તમામ શેરધારકોને ૨૮મી એજીએમની નોટિસની ઇલેક્ટ્રોનિક નકલો અને નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનાં વાર્ષિક અહેવાલ, ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મોકલવવામાં આવ્યા છે. આ નોટિસ અને અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.chartered.co.in</u> પર પણ ઉપલબ્ઘ છે. અન્ય તમામ શેરધારકો, જેઓનાં ઇ-મેઇલ સરનામાં નોંધાયેલા નથી, તેઓને એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ માન્ય પધ્ધત્તિ મુજબ તેમના નોંધાયેલા સરનામા પર, ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મોકલવામાં આવ્યાં છે.

કટ-ઓફ-તારીખ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ફિઝિકલ કે ડિમટિરિયલાઇઝ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો એજીએમનાં સ્થળ સિવાયના અન્ય સ્થળેથી સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ (ઇન્ડીયા) લિમિટેડ (સીડીએસએલ) પર ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ મારફતે એજીએમની નોટિસમાં ઉલ્લેખિત બાબતો પર ઇલેક્ટ્રોનિકલી મતદાન કરી શકે છે. ('રિમોટ ઇ-વોટિંગ').

તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે :

98

- ૧. એજીએમની નોટિસમાં નક્કી થયેલી કામગીરી માટે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન કરી શકાશે.
- િરિમોટ ઇ-વોટિંગ ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (સવારનાં ૯-૦૦ કલાકે) થી શરૂ થશે.
- ૩. રિમોટ ઇ-વોટિંગ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (સાજના ૫-૦૦ કલાકે) થી પૂર્ણ થશે. ૪. ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કે એજીએમમાં મતદાન કરવાની પાત્રતા નક્કી કરવા માટેની કટ-ઓફ-તારીખ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩છે.
- ૫. ઇલેક્ટ્રોનિક પધ્ધત્તિ દ્વારા ઇ-વોટિંગ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ૫-૦૦ કલાક પછી કરવા દેવાશે નહી.
- દ. મત આપવા ઇચ્છતા સભ્યો એ નોંધ લેવી કે : (એ) રિમોટ ઇ-વોટિંગ મોડયુલ, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી સીડી એસ એલ દ્વારા અક્ષમ કરવામાં આવશે અને સભ્ય એક વખત મતદાન કરશે પછી તેને બદલી શકશે નહીં, (બી) એજીએમમાં બેલેટ પેપર મારફતે મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, (ડી) એજીએમ અગાઉ રિમોટ ઇ-વોટિંગ મારફર્તે મતદાન કરનાર સભ્યો એજીએમમાં હાજર રહી શકે છે પણ તેમને એજીએમમાં મતદાન કરવાનો અધિકાર નથી, અને (ઇ) સભ્યોનાં રજીસ્ટરમાં નોંધાયેલ કે કટ ઓફ ડેટના રોજ ડિપોઝીટરીઝ દ્વારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં સભ્ય તરીકે નોંધાયેલી વ્યક્તિને જ રિમોટ ઇ-વોટિંગની સુવિધાનો લાભ લેવાનો કે એજીએમમાં બેલટ પેપર મારફતે મતદાન કરવાનો અધિકાર હશે.
- ૭. કંપનીએ ઇ-વોટિંગની પ્રક્રિયાને તટસ્થ અને પારદર્શક રીતે ચકાસવા સ્ક્રુટિનાઇઝર તરીકે, શ્રી યશ મેહતા, પ્રેક્ટિસીંગ કંપની સેક્રેટરી (સભ્યપદ નંબર ૨૧૨૧૪૩ અને સીઓપી નંબર ૧૬૫૩૫) ની નિમણુંક કરી છે.
- ૮. ૨૮મી વાર્ષિક સાધારણ સંભાની નોર્ટિસ કંપનીની વેબસાઇટ <u>www.chartered.co.in</u> પર તથા સીડીએસએલની વેબસાઇટ <u>www.cdslindia.com</u> પર પણ ઉપલબ્ધ છે.
- વોટિંગ સંબંધમાં કોઇપણ પ્રશ્ન હોય તો સભ્યો / લાભાર્થી માલિકો શેરધારકો માટે અવારનવાર પુછાતાં પ્રશ્નો (FAQ) જોઇ શકે છે અને <u>www.evotingindia.com</u> ના હેલ્પ વિભાગમાં ઉપલબ્ધ ઇ-વોટિંગ મેન્યુઅલ જોઇ શકે છે. ઇ-વોટિંગના સંબંધમાં કોઇપણ ફરિયાદ હોય તો કૃપા કરીને ઇ-મેઇલ: helpdesk.evoting@cdslindia.com

ાધુમાં સુચના આપવામાં આવે છે કે, કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૯૧ ને તે અનુસાર લાગુ પડતા ઘડાયેલા નિયમો અને સેબી (LODR) રેગ્યુલેશન, ૨૦૧૫નાં રેગ્યુલેશન ૪૨ ની સાથે વાંચતા તે અનુસાર કંપનીનુ રજીસ્ટર ઓર્ફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક, શુક્રવાર, સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૩ થી ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) વાર્ષિક સાધારણ સભાના હેતુથી બંધ રાખવામાં આવશે.

ચાર્ટર્ડ લોજિસ્ટિક લિમિટેડ વતી, તારીખઃ ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ કંપની સેકેટરી



SG FINSERVE LIMITED

Regd. Office: 37, Hargobind Enclave, Vikas Marg, Delhi-110092 Corporate Identity Number: L64990DL1994PLC057941 Tel.: 91-11-22373437

Website: www.sgfinserve.com, Email: compliance@sgfinserve.com

NOTICE OF 29th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION TO

This is in continuation to our earlier communication given on September 2, 2023, whereby Members of SG Finserve Limited ("the Company") were informed that in compliance with the ovisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder and the SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ["SEBI (LODR) Regulations"] read with Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 5, 2020 and Circulars No. 14/2020, 17/2020, 02/2021, 02/2022 dated April 8, 2020, April 13, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities and Exchange Board of India (SEBI Circulars), it was decided to convene the 29th Annual General Meeting ("AGM") of the Company on Tuesday, September 26, 2022 at 11:00 A.M. through Video Conferencing ("VC") facility, without the physical presence of the Members at a common venue, to transact the business as set out in the Notice of 29" AGM.

The process of sending the Notice of 29th AGM and Annual Report of the Company for the Financial Year ended March 31, 2023 along with login details for joining the AGM through VC facility including e-voting has been completed on Monday, September 2, 2023 through e-mail embers whose e-mail addresses were registered with the Company or the tegistrar and Share Transfer Agent or with their respective Depository Participants ("DP") in accordance with the above MCA Circulars and SEBI Circulars, and the same are also available on Company's website (www.moongipa.net), Stock Exchange websites ww.bseindia.com) and on the website of Central Depository Services Limited ("CDSL")

ww.evotingindia.com). ncompliance with the provisions of Section 108 of the Act read with the Companies Management and Administration) Rules, 2014, Regulation 44 of the SEBI (LODR) Regulations, Secretarial Standard - 2 issued by the Institute of Company Secretaries of India and MCA Circulars, the Members are provided with the facility to cast their votes electronically through remote e-voting (prior to AGM) and e-voting (during the AGM) services provided by

CDSL on all resolutions set forth in the Notice of the 29th AGM. The remote e-voting shall commence on Saturday, September 23, 2023 (10.00 A.M.) and shall end on Monday, September 25, 2023 (5.00 P.M.). During this period, member shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Tuesday mber 19, 2023 ("Cut-off date") may cast their votes electronically. The e-voting module shall be disabled by CDSL for voting. All the members are informed that:

- The Ordinary and the Special Businesses as set out in the Notice of AGM will be
- transacted through voting by electronic means; A person who is not a Member as on the cut off date should treat this Notice for
- Any person, who acquires shares and becomes a Member of the Company after the date Any person, who acquires shares and becomes a member of the company after the date of electronic dispatch of the Notice of 29th AGM and holding shares as on the Cut-off date, may obtain the Login ID and Password by following the instructions as mentioned in the Notice of the 29th AGM or sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password to cast their vote; and Members may note that: a) the remote e-voting module shall be disabled by the CDSL.
- after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again: c) the facility for voting through electronic mode shall be made available at the AGM: and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote evoting or voting at the AGM.

If you have not registered your e-mail address with the Company/DP, you may please follow the below instructions for obtaining login details for e-voting:

Physical Please provide necessary details like Folio No., Name of shareholder, scan copy of the share certificate (front and back), self-attested scanned copy of PAN card, self-attested scanned copy of Aadhar Card or any other document as proof of address by email to Company: compliance@sgfinserve.com or to RTA: compliances@skylinerta.com.

Please provide Demat account detials (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, self attested scanned copy of Aadhar Card or any other document as proof of addressto Company: compliance@sgfinserve.com or to RTA: compliances@skylinerta.com.

Shri Jatin Gupta, Practicing Company Secretary (Membership No.: FCS 5651: COP No. 5236), has been appointed as Scrutinizer by the Company to scrutinize the entire e-voting rocess in a fair and transparent manner.

The result of voting will be declared within 2 working days from the conclusion of AGM i.e. on or before September 28, 2023 and results so declared along with the consolidation Scrutinizer's Report will be placed on the Company's website (www.sgfinserve.com) and CDSL's website (www.evotingindia.com) and simultaneously communicated to the stock xchange i.e. BSE Limited at www.bseindia.com, where the Company's shares are listed. If you have any queries or issues regarding attending AGM or e-Voting from the e-Voting stem, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual

available at www.evotingindia.com, under help section or write an email to desk.evoting@cdslindia.com call toll free no. 1800225533. For and on behalf of SG Finserve Limited

Ritu Nagpal



isinesses as set forth in the notice convening the meeting ("Notice").

NOTICE OF 56[™] ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

lotice is hereby given that the 56th Annual General Meeting ("AGM") of the members of Modipo mited is scheduled to be held through video conferencing ("VC")/ other audio visual mea "OVAM") on Wednesday, 27th day of September, 2023 at 4.30 p.m. (IST) to transact the

accordance with the circulars issued by Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI"), the Notice alongwith the Annual Report for the financial year ended March 31, 2023 has been sent in electronic mode only to all the members whose email lds are registered with the Company/RTA/Depository. The electronic dispatch of the Annual Report and Notice has been completed on September 04, 2023. The Annual Report including the Notice is also available on Company's website www.modipon.net, the website of NSDI https://www.evoting.nsdl.com/ and on the website of BSE Limited at www.bseindia.com.

terms of applicable provisions, the Company has engaged the service of NSDL as agency providing e-voting facility (remote e-voting and e-voting during the AGM) to the members of the ompany to exercise their vote on the resolution proposed to be passed at the AGM by electron voting system.

The Members can ioin and attend the AGM through VC/OAVM facility only. The detaile ocedure for e-voting and participation in the AGM through VC/OAVM is provided in the notes to he Notice. The Members may join the Meeting thirty (30) minutes before the scheduled time an the login shall be kept open throughout the Meeting. The facility of participation at the AGM through VC/OAVM will be made available for 1,000 Members on a first come first served basis. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again. Those Members who participate in the AGM through VC/ OAVM and have not casted their vote through remote e-voting may cast their vot

The remote e-voting facility before the date of the AGM will be available during the following voting period (both days inclusive):

Commencement of remote e-voting From 9:00 am IST on Sunday, September 24, 2023 Upto 5:00 pm IST on Tuesday, September 26, 2023 and of remote e-voting he remote e-voting module shall not be allowed beyond the aforesaid date and time and shall b isabled by NSDL for voting thereafte

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficia wners maintained by the depositories as on the cut-off date i.e., Wednesday, September 20 023 only shall be entitled to avail the facility of remote e-voting before the AGM and facility of voting during the AGM. A person who is not a Member as on the cut-off date should treat the AGM Notice for information purpose only. Once the vote on a resolution is casted by the Member, the Member shall not be allowed to change it subsequently. The voting rights of the Members shall be n proportion to their shares of the paid-up equity share capital of the Company as on the cut-of late. Any person holding shares in physical mode or who acquires shares and becomes a Member of the Company after the Notice is sent and holds shares as on the cut-off date, ma obtain the login ID and password for facility of remote e-voting or e-voting during the AGM, as th

ase may be, by sending a request at evoting@nsdl.co.in. In case of any queries/ complaints related to e-voting, you may refer the Frequently Aske Questions ("FAQs") and e-Voting user manual for Shareholders available at the download sectio of www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in or contact Mr. Amit Vishal, at the designated e-mail to evoting@nsdl.co.in

Members whose email Id is not registered and who wish to receive the Notice, Annual Report an all other communications by the Company, from time to time, may get their email IDs registered b ubmitting Form ISR-1 to MAS Services Limited, the Registrar & Share Transfer Agent of the company, at investor@masserv.com or to the Company at vkthareja@modimangal.in. However or the shares held in demat mode, Members are requested to write to their respective DPs.

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013, rule 10 of the Companies (Management & Administration) Rules 2014 and regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the register of members and shar ransfer books of the Company will remain closed from Thursday, 21st September, 2023 t

Vednesday, 27th September, 2023 (both days inclusive) for the purpose of AGM The Voting results of the AGM alongwith Scrutiniser's Report will be declared as per the statutor imelines and will also be posted on the Company's website www.modipon.net, the website of the Voting and the Voting are the very support of the Voting and the Voting are the Voting and Voting are the Voting and Voting are the Voting are the Voting are the Voting and Voting are the V NSDL https://www.evoting.nsdl.com/ and on the website of BSE Limited www.bseindia.com.

For Modipon Limite Vineet Kumar Thareja Place : New Delhi Company Secretary and Compliance Officer Dated: September 04, 2023



રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં.20, સર્વે નં. 52, રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે નં. 27, હડમતાલા, રાજકોટ-360311 ગુજરાત

રહ્મી વાર્ષિક સામાન્ય સભા, બુક બંધ અને ઈ-વોટીંગ અંગે નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે પારમેક્ષ ફાર્મા લિમિટેડ (કંપની)નાં સભ્યોની રહમી વાર્ષિક સામાન્ય સભા (AGM) તારીખ રેલ્મી સપ્ટેમ્બર, ૨૦૨૩ને શુક્રવારના રોજ બપોરે ૩.૦૦ વાગે રજી. એડ્રેસ : પ્લોટ નં. 20, સર્વે નં. 52, રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે નં.27 હડમતાલા, રાજકોટ-360311 ખાતે ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૩ની બોર્ડ મીટીંગમાં AGMની જાણ કરતી નોટિસમાં જણાવેલ કામકાજ સારૂ મળશે.

કંપની /ડીપોઝટરી પાર્ટીસીપન્ટમાં જેમના ઈ-મેલ આઈડી નોંઘાચેલ છે तेपा सभ्योने रहमी AGMनी नोटिस अने नाएांडीय पर्ष ૨૦૨૨-૨૦૨૩નો વાર્ષિક અહેવાલ ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ છે. ભૌતિક સ્વરૂપે વાર્ષિક અહેવાલ મેળવવા ઈચ્છતા સભ્યોને વિનંતી પર **વિનામુલ્ચે મળી શકશે.**

આર્થી એવી પણ નોટિસ આપવામાં આવે છે કે કંપની ઘારા, ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેના અંતર્ગત બનાવેલા નિયમો તેમજ સેબી (એલઓડીઆર) નિયમો, ૨૦૧૫ના નિયમ ૪૨ અન્વયે કંપનીનાં સભ્યોના રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક્સ તારીખ ર૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (બન્ને દિવસો સહિત) ૨૯મી AGM નાં કામકાજ સારૂ બંધ રહેશે.

કોઇપણ વ્યક્તિ જે કંપનીનાં શેર મેળવે છે અને કંપનીનાં સભ્ય બને છે. જે જથી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ આ નોટિસ બાદ એટલે કે રસ્મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ શેર ધરાવતા તેઓ પોતાનો લોગીન આઈ.ડી. અને પાસવર્ડ helpdesk.evoting@cdslindia.com પર વિનંતી કરી મેળવી શકશે.

કંપની ઘારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સેબી (એલઓડીઆર) નિયમો, ૨૦૧૫ના નિયમ ૪૪ અન્વયે કંપની તેના સભ્યોને નોટિસમાં જણાવેલા ઠરાવો ઉપર મત આપવા માટે રિમોટ ઈ-વોટીંગ (એટલે કે AGMનાં સ્થળ સિવાયના અન્ય સ્થળે ઈ-વોટીંગ)ની સુવિધા આપે છે. કંપની ધારા, ૨૦૧૩ અને તેના અંતર્ગત બનાવેલા નિયમોની જોગવાઈ અનુસાર વિગતો નીચે મુજબ

- ૧) AGMની નોટિસ મોકલવાની કામગીરી પૂર્ણ કર્યાની તારીખ : ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૩
- ર) રીમોટ ઈ-વોટીંગના પ્રારંભની તારીખ અને સમય : રકમી સપ્ટેમ્બર, ૨૦૨૩, સવારે ૯-૦૦ વાગ્યે.
- 3) રીમોટ ઈ-વોટીંગના સમાપનની તારીખ અને સમય : ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, સાંજે ૫-૦૦ વાગ્ચે.
- ૪) રીમોટ ઈ-વોટીંગના હકક નકકી કરવા માટેની કટ ઓફ તારીખ : રરમી સપ્ટેમ્બર, ૨૦૨૩ ૫) કંપની દ્વારા AGMની નોટિસ મોકલાયા બાદ શેર **હ**સ્તગત કર્યા
- હોંય અને કંપનીના સભ્યો બન્યા હોય તેમજ કટ ઓફ ડેટ સુધીમાં ડીપોઝટરી દ્વારા જાળવવામાં આવતા સ્ટેટમેન્ટ ઓફ બેનિફિશિયલ ઓનર્સ / કંપનીના સભ્યોના રજસ્ટરમાં નામ ધરાવતા હોય તેવી વ્યકિત AGMની નોટિસમાં દર્શાવેલી પ્રક્રિયા બાદ રીમોટ ઈ-વોર્ટીગ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
- ક) રીમોટ ઈ-વોટીંગ કરી શકશે નહી : ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, સાંજે ૫.૦૦ વાગ્યા પછી.
- હ) AGMના સ્થળે ઠરાવો પર મત આપવાની રીત : AGM ના સ્થળે 'બેલેટ પેપર'' દ્વારા મત આપવાની સુવિધા ઉપલબ્ધ **દ**શે. AGM ના સ્થળે ઈ-વોટીંગની સુવિધા ઉપલબ્ધ થશે નહી. જે સભ્યોએ AGM પહેલા રીમોટ ઈ-વોર્ટીંગ દ્વારા તેમનો મત આપી દીધો હશે તે AGM માં ઉપસ્થિત રહી શકશે પરંતુ AGM માં મત આપવા માટે હકકદાર રહેશે નહી.
- ૮) રલ્મી AGM ની નોટિસ કંપનીની અને સીડીએસએલની વેબસાઈટ www.parmaxpharma.com અને www.evotingindia.com ઉપર ઉપલબ્ધ છે.
- ક) રીમોટ ઇ-વોટિંગ અંગે ફરિયાદ માટે શેરહોલ્કર્સ www.evotingindia.com નાં હેલ્પ સેક્શનમાં Frequently Asked Questions ("FAQs") અને ઈ-વોર્ટિંગ મેન્યુલનો ઉપયોગ કરે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેલ કરી શકે

સ્થળ : - હ્ર્ડમતાલા તારીખ :- ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૩

બોર્ડની સુચના અનુસાર પારમેક્ષ ફાર્મા લિમિટેક વતી, એસડી/-ઉમંગ ગોસલીયા भेनेछंग डिरेडरर Din No.: 05153830



આથી.

રીજનલ ઓકીસ : કોટક મહીન્દ્રા બેંક લી.. ૨૨૩–૨૨૯

અમદાવાદ, મંગળવાર, તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

સિધ્ધીવિનાચક કોમ્પલેક્ષ, શીવરંજની, સેટેલાઇટ, અમદા Kotak Mahindra Bank - 3cooqu કબજા નોટીસ

(सिडयुरीटी ઈन्टरेस्ट (એन्डोर्समेन्ट) नियम २००२ न પરિશિષ્ટ ૪ સાથે રુલ ૮ (૧) વંચાણે લેતા)

કોટક મહીન્દ્રા બેંક લી., ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ બેંકીંગ કંપની મેંકીંગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ ની વ્યાખ્યામાં જેની રજીસ્ટર્ડ ઓફીસ : ૨૭બીકેસી, સી ૨૭, જી બ્લોક, બાંદ્રા કુરલા કોમ્પલેક્ષ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૫૧ અને શાખા ઓફીસ રાજકોટ સ્થિત સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા ક્લમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ તથા નિયમ ૯ અંતર્ગત વંચાણે લેતાં **તા. ૧૩.૦૧.૨૦૨૩** ના રોજ ઉદ્યારકર્તા **૧. મેસર્સ** આયુધ ઇમ્પેક્ષ પ્રા.લિ. (ઉધારકર્તા) ૨. અલ્પેશ ૨વજીભાઈ મોરડીયા (ડિરેક્ટર / ગિરવેદાર / જામીનદાર) ૩. સુરેશભાઈ રવજીભાઈ મોરડિયા (ડિરેક્ટર / જામીનદાર) ૪. કૈલાશબેન એસ. મોરડિયા (જામીનદાર) ૫. ભવદીપકુમાર અરૂણભાઈ દવે (ગિરવેદાર) F. ગાયગ્રીદેવી અશોકભાઈ ગઢવી (જામીનદાર) હ. ચેતનભાઈ અરૂણભાઈ દવે (જામીનદાર / ગિરવેદાર) ને નોટીસમાં દર્શાવેલી ૨કમ રૂા. ૧,૬૬,૧૨,૪૦૪.૧૨/- (રૂા. એક કરોડ છાંસઠ લાખ બાર હજાર ચારસો ચાર રૂપિયા અને બાર પૈસા ફકત) તા. ou.oq.२o२3 ના રોજથી નોટીસમાં જણાવ્યા મુબજ નોટીસની તારીખથી દ્o દિવસોની અંદર ચુકવવા જણાવેલ.

ઉપરોક્ત ઉધારકર્તા રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ખાસ કરીને ઉપર જણાવેલ ઉધારકર્તા અને સામાન્યત: જાહેર જનતાને નોટીસ થી જણાવવામાં આવે છે કે અધિનિયમ ૧૩(૪) ની સાથે ઉક્ત નિયમોના નિયમ ૯ ને વંચાણે લેતા **તા. ૦૩.૦૯.૨૦૨**૩ ના રોજ ઝધોહસ્તાૃક્ષરીએ નીચે જણાવ્યા મુજબની મિલક્તનો **પ્રત્યક્ષ કબજો** લીધેલ છે.

ઉદ્યારકર્તા ને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઇપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ મિલકત અંગે કરેલો કોઇપણ વ્યવહાર કોટક મહીન્દ્રા બેંક લીમીટેડની બાકી રૂા. ૧,૬૬,૧૨,૪૦૪.૧૨/- (રૂા. એક કરોડ છાંસઠ લાખ બાર હજાર ચારસો ચાર રૂપિયા અને બાર પૈસા ફકત) તા. **૦૫.૦૧.૨૦૨૩ ના રોજ** ચડત વ્યાજ સાથે કરાર આધારીત દરે રકમ, આનુસાંગીક ખર્ચા, કોસ્ટ, ચાર્જીસ વગેરે **તા. ૦૬.૦૧.૨૦૨૩** થી આજ તારીખ સુધી બોજાને આંધીન રહેશે. સદરહું કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાની મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમચ બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતની વિગત !થાવર મિલકત પ્લોટ નં. ૧૧/એ જમીનનું ક્ષેત્રફળ ૧૬૭.૨૨ સ્કે.મીટર્સ સુપરસ્ટ્રક્ચર બાંધકામ સાથે બંને બાજુ વડવા રેવન્યુ સર્વે નં. ૨૫૨ પૈકી, લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે સ્થિત, ગૌરી શંકર તળાવ પાસે, બાલ વાટિકા પાસે, ગામ વડવા, તાલુકા અને જીલ્લો ભાવનગર, ગુજરાત રાજ્ય ખાતે આવેલ સમગ્ર મિલકત જેની ચર્તુ:સીમા: પૂર્વે: જોડેનો પ્લોટ નં. ૧૦, પશ્ચિમે: જોડેનો પ્લોટ નં. ૧૧/બી, ઉત્તરે: સર્વે નં. ૨૫૨ પૈકોની ખુલ્લી જમીન, દક્ષિણે: જોડેનો પ્લોટ નં. ૧૫.

તારીખ : ૦૩.૦૯.૨૦૨૩ പ്രാലം വിവഴാ

અધિકૃત અધિકારી, કોટક મહીન્દ્રા બેંક લી.

FTTTT LT I INDUSTRIES LIMITED

CIN NO.: L45200GJ1988PLC011049
egd. Office: 504, Trividh Chambers, Opp. Fire Station, Ring Road, Surat - 395 002. India
E-mail: corporate@sumeetindustries.com, Visit us at: www.sumeetindustries.com

વાર્ષિક સામાન્ય સભા, ઈ-મતદાન અને ચોપડા બંધની તારીખની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે સુમિત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની ૩૫મી વાર્ષિક સમાન્ય સભા (એજીએમ), વિડીયો કોન્ફરાંસિંગ ('વિસી') અથવા અન્ય ઓડિયો વિઝયુઅલ મીન્સ ('ઓએવીએમ') મારફત બુધવાર, તા. ૨७ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૫:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અર્ફેસ (એમસીએ) દ્વારા જારી કરવામાં આવેલ સામાન્થ પરિપત્ર ક્રમાંક-૧૦/૨૦૨૨ તા. ૨૮/૧૨/૨૦૨૨ જેને પરિપત્ર ક્રમાંક ૨૦/૨૦૨૦ તા. ૦૫/૨૦૨૦ અને ૨/૨૦૨૨ તા.૦૫/૦૫/૨૦૨૨ જેને સિક્યુરિટિઝ એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ના સેબી/એચઓ/સીએફડી/પીઓડી-ર/પી/સીઆઈઆર ૨૦૨૩/૪ તા. ૦૫/૦૨/૨૦૨૩ દ્વારા જારી કરવામાં આવેલ (અહીંથી આગળ સંચુકત રીતે 'પરિપત્રો' તરીકે ઓળખવા) તે મુજબ કંપનીઓએ સભ્યોની શારીરિક ઉપસ્થિતી વગર વીસી/ઓએવીએમ મારફત એજીએમ આચોજીત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. તેથી તા.૨७ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ની એજીએમની નોટિસમાં દર્શાવેલ સાધારણ કામકાજ તથા ખાસ કામકાજોને બહાલી આપવા માટે વીસી/ઓએવીએમ મારફત કંપનીની એજીએમ રાખવામાં આવી રહી છે.

પરિપત્રો મુજબ, કંપની/ડિપોઝીટરી પાર્ટિસપેન્ટ (ડીપી) પાસે જે સભાસદોની ઈમેલ આઈડી નોંધાચેલી છે, એ સભાસદોને ૩૫મી એજીએમની નોટીસની અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩ ની ઈલેક્ટ્રોનિક નકલ મોકલવામાં આવી રહી છે. આ વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.sumeetindustries.com અને સ્ટોક એક્ષચેંજની વેબસાઈટ નેશનલ સ્ટોક એક્ષચેંજ ઓફ ઈન્ડિયા લિમિટેડ अने जीओसर्र लिभिटेडनी अनुडमे www.nseindia.com अने www.bseindia.com અને બીગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ www.bigshareonline.com પર પણ ઉપલબ્ધ છે, તેમજ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) ની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. ઈમેલ મારફત એજીએમની નોટીસ અને એન્યુઅલ રિપોર્ટ મોકલવાનું કામ તા. ૦૪ થી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પુરું થઈ ગયેલ છે. કંપની અદિનિયમ, ૨૦૧૩ના નિયમ ૯૧ સુસંગત જોગવાઈઓના તેમજ સેબી

(લિસ્ટીંગ ઓબ્લીગેશન એન્ડ ડિસ્કલોઝર રિકવાચરમેન્ટસ) નિયમો ૨૦૧૫ના નિયમ ૪૨ અનુસરણમાં એ પણ સૂચિત કરવામાં આવે છે કે એજીએમ આયોજીત કરવાના હેતુ માટે સભાસદોનું રજસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફરના ચોપડા ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨७મી સપ્ટેમ્બર ૨૦૨૩ (બન્ને દિવસ સહિત) બંધ રાખવામાં આવેલ છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૮ ની જોગવાઈઓ તથા તે હેઠળના

મોબ્લિગેશન્સ એન્ડ ડિસ્લોઝર રી વાચરમેન્ટ્સ) ૨૦૧૫ ના નિચમ ૪૪ મુજબ, કંપની પોતાના સભાસદોને ઈ-વોટીંગ સુવિધા પુરી પાડી રહેલ છે. નોટીસમાં દર્શાવેલ બધાજ ઠરાવો માટે સભાસદો પોતાનો મત રિમોટ ઈ-વોર્ટીગ/ઈ-વોર્ટીગ દ્વારા આપી શકશે. જેની પ્રક્રિયા બીગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. કંપની / રજીસ્ટ્રાર તેમજ ડિપોઝિટરી પાસે જે સભાસદોના ઈમેલ આઈડી ની

नियमो अने सीडयुरीटीઝ એન્ડ એક્સરોંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ

विगतो होय तेमने नोटिस भोडलवानुं तथा युजर आईडी अने सीडवन्स નંબરની વિગતો સાથે ઈમેલ મોકલવાનું કામ તા.૦૪ થી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ

કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ના, પેટા નિયમ ૨૦ મુજબ સભ્યોને નીચેની જાણકારી પૂરી પાડવામાં આવેલ છે.

૧) રિમોટ ઈ-વોટિંગનો પ્રારંભ તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના સવારે ૯:૦૦ કલાક (ભારતીય સમયાનુસાર) શરૂ થશે અને તા. ૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના સાંજ ના ૫:૦૦ કલાકે (ભારતીય સમયાનુસાર) બંધ થશે. શેરધારકોને ઈલેક્ટ્રોનિક મતદાન માટે તારીખ ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના સાંજના ૫:00 કલાકે (ભારતીય સમયાનુસાર) સમય વિત્યા પછી ઈ-વોર્ટિંગ કરી શકશે નહીં. કંપનીના સભાસદો, તા. ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ની કટ-ઓફ તારીખે જેટલા શેર ધરાવતા હશે તે મુજબ તેમના મત, ઈલેક્ટ્રોનિક મતદાન દ્વારા આપી શકશે. ર) કોઈપણ વ્યકિત કે જેની પાસે કટ-ઓફ તા. ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ કંપની ના શેર્સ હોય તેમજ નોટિસ મોકલ્યા તારીખ પછી કંપનીના સભ્ય બને તેવા સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ/ઈ-વોટિંગ કરવા કંપનીના શેર ટ્રાન્સફર એલન્ટનો સંપર્ક કરવો. જોકે, જે તે વ્યકિતની રિમોટ ઈ-વોર્ટિંગ માટે સેન્ટલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડમાં નોંધણી થઈ ગયેલ હોય તો મત આપવા માટે તેઓ તેમના હાલના ચૂઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે અને नवा युअर्से रिमोट ई-वोटिंग माटे जीगशेर सर्विसीस प्राईवेट विमिटेड https://lvote.bigshareonline.com ઉપયોગ કરી શકે છે.

સભાસદોને નીચેની બાબતોની નોંધ લેવાની વિનંતી કરીએ છીએ : ૧) મતદાન માટેનું રિમોટ ઈ-મતદાન મોડચૂલ રદ્દમી સપ્ટેમ્બર ૨૦૨૩ રોજ સાંજે

૫:૦૦ કલાક પછી સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે. ૨) એજીએમ દરમ્યાન ઈ-મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

3) જે સભાસદો ઓનલાઈન સુવિધા મારફત સભામાં હાજર રહેશે અને જેમણે રિમોટ ઈ-મતદાન દ્વારા તેમના મત નોંધાવ્યા નહિ હોય અને જેમને મત આપવા પ્રતિબંધિત કરવામાં ન આવ્યા હોય એવા સભાસદો પહેલેથી જ રિમોટ ઈ-મતદાન મારફત તેમનાં મત આપ્યો હશે તેઓ સભામાં ઓનલાઈન સુવિધા મારફત હાજરી આપી શકશે પરંતુ એજીએમ દરમિયાન તેમના મત આપવા માટે હકદાર रहेशे नहि.

વધુમાં જે સભાસદોએ પોતાનો ઈમેલ એડ્રેસ નોંધાવ્યા નથી અથવા જેઓ નવો ઈમેલ એડ્રેસ અપડેટ કરવા માગે છે, એવા સભાસદો ચોગ્ચ વિગતો સાથે તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ પર સહી કર્યા બાદ એ નકલ info@bigshareonline.com પર મોકલી આપવી તેમજ અહીં જણાવેલ લીક "http://bigshareonline.com/InvestorRegistration.aspx" น≥ ชย์ તમારી વિગતો અપડેટ કરી શકો છો. ઈ-મતદાનથી સંબધિત કોઈપણ પૂછપરછ અથવા ફરિચાદ માટે, https://ivote.bigshareonline.com પર ઉપલબ્ધ हेल्प विભाग हेहण ि्रहवेंटली आइसड इवेश्वन्स ("अेइओ यु") तेमक સભાસદો માટેનું ઇ-વોટિંગ મેન્યુઅલ જોઇ શકે છે અથવા ivote@bigshareonline.com ને ઇમેલ લખી શકે છે તેમજ ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૪ ૨૨ ઉપર સંપર્ક કરી શકે છે.

કંપનીએ ધીરેન આર. દવે એન્ડ કું. (UIN No.P1996GJ002900) પ્રે ટીસીંગ કંપની સેક્રેટરીઝની રિમોટ ઈ-વોર્ટિંગની પ્રક્રિયા વ્યાજબી અને પારદર્શક ધોરણે થાય તે માટે સ્ક્રુટીનાઈઝર તરીકે નિમણૂંક કરી છે.

રિમોટ ઈ-મતદાન અને એજીએમ ખાતેના ઈ-મતદાનનાં પરિણામો એજીએમ સમાપ્ત થયાના અડતાલીસ કલાકમાં જાહેર કરવામાં આવશે અને આ પરિણામો કંપનીની વેબસાઈટ www.sumeetindustries.com અને સ્ટોક એક્ષરોંજની વેબસાઈટ નેશનલ સ્ટોક એક્ષચેંજ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બીએસઈ લિમિટેડની અનુક્રમે www.nseindia.com અને www.bseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

सुमित र्घन्डस्ट्रीञ लिमिटेड સ્થળ : સુરત અનિલ કુમાર જૈન (કંપની સેકેટરી) ता : ०४/०**८/२०**२३ ACS-17137

Genus

GENUS PAPER & BOARDS LIMITED

Regd. Office: Vill. Aghwanpur, Kanth Road, Moradabad-244001 (U.P.)

NOTICE OF ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION Notice is hereby given that the 12" Annual General Meeting ("AGM") of the Members of Genus Paper & Boards Limited ("the Company") is scheduled to be held on Wednesday, September 27, 2023 at 11:30 a.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with the applicable circulars issued by the Ministry of Corporate Affairs and the SEBI in this regard (Collectively referred to as "applicable circulars") to transact the business as set forth in the Notice of AGM. The Members can join the AGM in the VC/OAVM mode 30 minutes before and after the scheduled time of the commencement of AGM by following the procedure mentioned can join the AGM in the VC/DAVM mode 30 minutes before and after the scheduled time of the commencement or AGM by 1000mg the procedure mentioned in the Notice of AGM. In accordance with the applicable circulars, the Notice of AGM and Annual Report for the financial year 2022-23 have been sent on September 04, 2023 to all the Members of the Company whose email addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid documents are also available on website of the Company at www.evolingindia.com and website of the Stock Exchanges at www.evolingindia.com and website of the Stock Exchanges at www.evolingindia.com and website of the Stock Exchanges at www.nesindia.com and www.nesindia.com and well and the Stock Exchanges at www.nesindia.com and well and the Stock Exchanges at www.nesindia.com and well and stock at the s

Regulation 44 of the SEBI Listing Regulations, and applicable circulars, members holding shares as on the cut-off date i.e. September 20, 2023 may cast their vote electronically on the business as set forth in the Notice of AGM through remote e-voting or e-voting during the AGM. The detailed procedure or instructions for e-voting are contained in the Notice of AGM. In this regard, the Members are hereby informed that:

(i) The remote e-voting shall commence on Sunday, September 24, 2023 at 9.00 am (IST) and end on Tuesday, September 26, 2023 at 5.00 pm (IST). The

remote e-voting shall not be allowed beyond the said date and time.

Place: Moradabad

Date: September 04, 2023

remote e-voting shall not be allowed beyond the said date and time.

The remote e-voting module shall be disabled by CDSL for voting after 5.00 p.m. (IST) on September 26, 2023.

It is hereby clarified that it is not mandatory for a member to vote using the remote e-voting facility. Members have also an option to cast their vote through e-voting by attending the AGM. Members can opt for only one mode of voting. The Members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.

(iv) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date, i.e. September 20, 2023 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM. A person, who is not a Member as on the said cut-off date, should treat this Notice or Notice of AGM for information purposes only.

(v) Any person who has acquired shares of the Company and become member after dispatch of the Notice of AGM and holding shares as on cut-off date i.e. Wednesday, September 20, 2023 may obtain login ID and password by sending a request to the Company at cs@genuspaper.com or to the RTA at nichetechpi@nichetechpi.com. However, if a person is already registered with CDSL for e-voting then existing login ID and password can be used for casting vote.

of the shareholders, who are present in the AGM through VC/OAVM facility and have not casted their vote on the Resolutions through remote e-Voting an

are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM.

(vii) Member participating through the VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

(viii) In case of any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System members may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 22 55 33.

toll free no. 1800 42 50 33.

(ix) All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call toll free no. 1800 22 55 33.

(x) The Company has appointed Ms. Komal, Practicing Company Secretary (FCS No.11636, CP No.17597) (M/s. Komal & Associates), of Delhi, as the Scrutinizer to scrutinize the remote e-voting process prior to the AGM and e-voting during the AGM in a fair and transparent manner.

The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Thursday, September 21, 2023 to Wednesday, September 27, 2023 (hoth days inclusive) for the purpose of AGM. 2023 (both days inclusive) for the purpose of AGM.

By Order of the Board Kunal Nava

KINTECH RENEWABLES LIMITED Registered Office: Kintech House, 8, Shivalik Plaza, Opp. AMA, IIM Road, Ahmedabad, Gujarat 380015, India

Ph. No.: +079-26303064 / 26303074; Fax: +079-26303052

E-mail ID: <u>cs@kintechrenewables.com</u>, <u>cskintechrenewables@gmail.com</u> Website: <u>www.kintechrenewables.com</u> CIN: L46102GJ1985PLC013254

Recommendations of the Committee of Independent Directors ('IDC') for the Open Offer to the Shareholders of Kintech Renewable Limited (hereinafter referred to as 'the Company'/ 'Target Company') by Mr. Dhruv Gupta and Mrs. Meenakshi Gupta (hereinafte referred to as 'Acquirers') under Regulation 26(7) of Securities and Exchange Board of India (Substantial Acquisition of Share: and Takeovers) Regulations, 2011 ('SEBI (SAST) Regulations, 2011').

and Takeovers) Regulations, 2011 ('SEBI (SAST) Regulations, 2011').								
1.	Date		tember 02, 2023					
2.	Name of the Company		ech Renewables Limited					
3.	Details of the Offer pertaining to the Company	25.0 450.	n Offer for acquisition of upto 10,00,000 (Ten Lakh) Equity Sha 0% of the Expanded Share Capital of the Target Company at an 00/- (Indian Rupees Four Hundred and Fifty Only) per fully pai able in cash	Offer Price of INR				
4.	Name of the Acquirers	• M	r. Dhruv Gupta ('Acquirer 1') rs. Meenakshi Gupta ('Acquirer 2')					
5.	Name of the PAC	NA						
6.	Name of the Manager to the Offer		porate Professionals Capital Private Limited					
7.	Members of the Committee of Independent Directors	Mr. A	Prakash Kumar Singh- Chairperson Arihant Chopra- Member					
8.	IDC Member's relationship with the Company		IDC members are Independent Directors of the Company.					
9.	Trading in the Equity shares/ other securities of the Company by IDC Members IDC Member's relationship with	None of the IDC members hold any shares of the Company and neither have they traded in any equity shares / other securities of the Company during a period of 12 months prior to the date of Public Announcement and since then till date. The IDC members do not have any relationship with the Acquirers.						
11.	the Acquirer Trading in the Equity shares/ other securities of the Acquirer by	Not.	Applicable					
12.	Recommendation on the Open offer, as to whether the offer is fair and reasonable	Based on the review of the Public Announcement and the Detailed Public Statement issued by the Manager to the Offer on behalf of the Acquirers, IDC believe that the Open Offer is in accordance with SEBI (SAST) Regulations, 2011 and to that extent is fair and reasonable. The shareholders should independently evaluate the offer and take their own informed decision. They are also advised to seek expert tax opinion before taking their decision in this regard.						
13.	Summary of reasons for recommendation	Acquirer 2 has entered into a SPA dated April 03, 2023 with the Sellers for acquisition of 7,50,000 (Seven Lakh and Fifty Thousand) Equity Shares representing 75.00% of the Pre-Issue Paid-up Equity Share Capital of the Target Company of Face Value of INR 10.00/- (Indian Rupees Ten Only) at a price of INR 305.00/- (Indian Rupees Three Hundred and Fiwe Only) per Equity Share of the Target Company aggregating to INR 22,87,50,000/- (Indian Rupees Twenty Two Crores Eighty Seven Lakh and Fifty Thousand only) to be paid in cash. Also, the Board of Directors of the Target Company in their meeting held on April 03, 2023, approved the issuance of 22,50,000 (Twenty Two Lakh and Fifty Thousand) Equity Shares of face value of INR 10 (Indian Rupees Ten only) each equity shares to Acquirer 1 and 7,50,000 (Seven Lakh and Fifty Thousand) Equity Shares of face value of INR 10 (Indian Rupees Ten only) each equity shares to Public Shareholders, inter alia approval from the shareholders of the Target Company was received on May 05, 2023 through postal ballot and further allotted by the Board of Directors of the Target Company in their meeting held on July 10, 2023. It has triggered the requirement to make Open Offer under Regulation 3(1) and Regulation 4 of SEBI (SAST) Regulations. The equity shares of the Company are listed and traded on the bourses of BSE and are frequently traded within the meaning of definition of 'frequently traded shares' under clause (j) of Sub-Regulation (1) of Regulation 2 of the SEBI (SAST) Regulations) on BSE. The Offer Price of INR 450.00/- (Indian Rupees Four Hundred and Fifty Only) is justified, in terms of Regulation 8(2) of the SEBI (SAST) Regulations, being the highest of the following -						
		S. No.	Particulars	Price				
		(a)	The highest negotiated price per share of the target company for any acquisition under the agreement attracting the obligation to make a public announcement of an open offer	For SPA - INR 305/- For Preferential Issue - INR 450/-				
		(b)	The volume-weighted average price paid or payable for acquisition by the Acquirers along with their persons acting in concert during 52 weeks immediately preceding the date of Public Announcement	Not Applicable				
		(c)	The highest price paid or payable for any acquisition by the Acquirers along with their persons acting in concerts during 26 weeks immediately preceding the date of the Public Announcement	Not Applicable				
		(d)	The volume-weighted average market price of shares for a period of sixty trading days immediately preceding the date of the public announcement as traded on the stock exchange where the maximum volume of trading in the shares of the target company are recorded during such period, provided such shares are frequently traded	INR 434.18/-				
		(e)	The Equity Shares are not frequently traded, the price determined by the Acquirer and the Manager to the Offer considering valuation parameters including book value, comparable trading multiples, and such other parameters as are customary for valuation of shares of such companies	Not Applicable, since the equity shares of the Target Company are frequently traded				
		In view of the parameters considered and presented in table above, in the o the Acquirers and the Manager to the Offer, the Offer Price INR 450.00/Rupees Four Hundred and Fifty Only) per share is justified in terms of Reg of the SEBI (SAST) Regulations.						
14.	Details of Independent Advisors, if any.	None						

"To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respect, true and correct and not misleading, whether by omission of any information or otherwise and includes all the information required to be disclosed by the Company under the Takeover Code.

Any other matter(s) to be

15.

For and on behalf of The Committee of Independent Directors (Kintech Renewables Limited)

Date: September 05, 2023 Chairperson - Committee of Independent Directors Dishman Carbogen Amcis

દિશમાન કાર્બોજીન એમ્સીસ લીમીટેડ

રજાસ્ટર્ક ઓકીસ : દિશમાન કોર્પોરેટ હાઉસ, ઇસ્કોન-બોપલ રોડ, આંબલી, અમદાવાદ-૩૮૦૦૫૮ ફોન નં. ૦૨૭૧૭-૪૨૦૧૦૨/૧૨૪ CIN : L74900GJ2007PLC051338 દમેદલ : grievance@imdcal.com વેબસાદટ : www.imdcal.com

૧૬મી વાર્ષિક સાધારણ સભા અને ઈ–વો<u>ટીંગ માહિતીની નોટીસ</u>

નાથી નોટીસ આપવામાં આવે છે કે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના પરિપત્ર નં. ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિપત્ર નં ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં. ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦, પરિષત્ર નં. ૦૨/૨૦૨ તા.૧૩મીજાન્યુઆરી,૨૦૨૧,પરિષત્રનં.૦૨/૨૦૨૨તા.૫મીમે,૨૦૨૨અનેપરિષત્રનં.૧૦/૨૦૨૨તા.૨૮મી ડિસેમ્બર,૨૦૨: તે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે ૨૦૨૦, પરિષત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧, પરિષત્ર નં SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તા. ૧૩મી મે, ૨૦૨૨ અને પરિષત્ર નં. SEBI/HO/CFD/PoD 2/P/CIR/2023/4તા. ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ (''પરિષત્રો")ની સાથે વાંચી તેનું અને અન્ય તમામ લાગુ પડતા કાયદ્યનું પાલન કરતા કંપની ના સભ્યોની ૧૬મી વાર્ષિક સાંધારણ સભા (એજીએમ) ની નોટીસમાં દર્શાવેલ સાંમાન્ય અને વિશેષ કામકાજ કરવા માટે **બુધવાર, ૨**હ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે ૧૫:૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સિંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝયુઅલ <mark>ાલ્યમો (ઓએવીએમ)</mark> થકી યોજાશે. સભ્યો ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા જ એજીએમમાં હાજર રહી શકશે અને ભાગ પણ લઈ શકશે ઉપરોક્ત પરિપત્રોના અનુસંધાનમાં, એજીએમની નોટીસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩ ના વર્ષનો જે સભ્યોના ઇમેઇલ સરનામાં કંપનીન રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ / ડિપોઝિટરી સહભાગીઓ સમક્ષ નોંધાયેલ છે, તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમથી ૪ સપ્ટેમ્બર, ૨૦૨ ના રોજ મોકલવામાં આવેલ છે. એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ ના વર્ષનો કંપનીની વેબસાઇટ <u>www.imdcal.com</u> સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લીમીટેડ અનુક્રમે <u>www.bseindia.com</u> ાથા <u>www.nseindia.com</u> અને સીડીએસએલની વેબસાઇટ <u>www.evotingindia.com</u> ઉપર પણ ઉપલબ

ડિમટીરિયલાઇઝ્ડ મા<mark>ઘ્યમમાં શેર ધરાવતા સભ્યો અને જેમના ઇમેઇલ સરનામાની નોંઘણી થયેલ નથી, તેમને તેમના ઇમેઇલ સરનામાં તેમન</mark> ડેપોઝિટરી સહભાગીઓ સાથે નોંધણી કરવા વિનંતી છે. પ્રત્યક્ષ માધ્યમમાં શેર ધરાવતા સભ્યોને વિનંતી છે કે તમારા ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર ફોર્મ ISR-1 માં ભરી કે જે કંપની વેબસાઇટ https://www.imdcal.com/investor-relations ઉપર ''એટેન્શન ડ્ ફ્રીઝીકલ શેરહોલ્ડર્સ'' શીર્ષક હેકળ તેમજ રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) ની વેબસાઇટ nttps://web.linkintime.co.in/KYC-downloads.html પર પ્રાપ્ત છે, તે કંપનીને તેના ઇમેઇલ <u>grievance@imdcal</u> ઉપ મોકલી આપે.

યોને ઇલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ થકી એજીએમની નોટીસમાં દર્શાવ્યા મુજબના કામકાજ પર દૂરથી (હાજર રહ્યા વગર)તેમનો મત આપવાન તક મળશે. ડિમેટીરિયલાઇઝડ માધ્યમમાં, પ્રત્યક્ષ માધ્યમમાં શેરો ધરાવતા સભ્યો અને જેમના ઇમેઇલ સરનામા નોંધાર્યા નથી તેવા સભ્યો માટે રિમોટ ઈ-વોટીંગ, એજીએમમાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહેવા તથા એજીએમ દરમિયાન ઈ-વોટીંગ આપવાની પહૃતિ એજીએમની નોટીસમ

ઉપરોક્ત પરિપત્રો અને કંપની ધારા ૨૦૧૩ ની કલમ ૧૦૮ ને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ) રૂલ્સ, ૨૦૧૪ ('નિયમ')ના નિયમ ૦ સાથે વાંચતા અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડડિસક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમ ૪૪ અન્વયે, એજીએમન નોટીસમાં વર્ણવવામાં આવેલા તમામ કરાવો ઉપર સભ્યોને તેમનો મત ઇલેક્ટ્રોનિકલી આપવા માટે રિમોટ ઈ-વોટીંગની સુવિધા, એજીએમમ વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહેવા અને એજીએમ કરમિયાન ઈ-વોટીંગ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સંદર્ભે, કંપનીએ ઉપરોક્ત સુવિધાઓ પ્રદાન કરવા માટે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લીમીટેડ ('સીડીએસએલ') ની નિયુક્તિ કરી છે. બધા સભ્યોને જણાવવામાં આવે છે કે :

બે) મતના અધિકારો સભ્યો પાસે **બુધવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૭ (કટ–ઓફ તારીખ)** ના રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાન આધારે પ્રમાણસર ગણાશે અને જે સભ્ય કટ–ઓફ તારીખના રોજ ભૌતિક તથા ઊમેટ સ્વરૂપે શેર ધારણ કરતું હોય, તે સભ્યને રીમોર ઈ–વોટીંગ તથા એજીએમ દરમિયાન ઈ–વોટીંગ સુવિધા દ્વારા મત આપવાની સુવિધા મળશે. સભાની નોટીસ મોકલી આપ્યા પછી કોઈ વ્યક્તિ કંપનીની સભ્ય બની હોય તો અને તેનો કટ-ઓફ તારીખના રોજ શેર્સ ધરાવતી હોય તો તેઓએ યુઝર આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરવા મા કંપનીની વેબસાઇટ ઉપર અપલોડ થયેલ એજીએમની નોટીસમાં ''ઈ-વોટીંગ સૂચના" શીર્ષક હેંકળ થયેલ સૂચનોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે જે <u>https://www.evotingindia.com</u> ઉપર સહાય વિભાગમાં પણ ઉપલબ્ધ છે. જો એ વ્યક્તિ સીડીએસએલ/એનએસડીએલ સમક્ષ ઈ-વોટીંગ માટે અગાઉથી જ નોંધાયેલી હોય તો તેઓ પોતાના એ જ યુઝર આઇડી અને પાસવર્ડન ઉપયોગથી પોતાનો મત આપી શકે.

એજીએમ દરમિયાન ઈ-વોટીંગ આપવાની સુવિધા એજીએમમાં એ સભ્યોને ઉપલબ્ધ કરવામાં આવશે જેમને રિમોટ ઈ-વોટીંગ વિકલ્પનો ઉપયોગ ન કર્યો હોય અને જે સભ્યો એજીએમ^{માં} વીસી / ઓએવીએમ દ્વારા હાજર રહ્યા હશે અને જે અન્યથા આમ કરવાથી પ્રતિબંધિત નથી તેવા સભ્યો એજીએમ દરમિયાન ઈ-વોટીંગ દ્વારા મત આપી શકશે.

સી) સભ્યો જેમણે એજીએમ પહેલા ટીમોટ ઈ-વોટીંગથી તેમનો મત આપ્યો હોય, તેઓ એજીએમમાં વીસી/ઓએવીએમ દ્રારા હાજર રહી શકશે પરંત ફરીથી મત આપવા હક્કદાર રહેશે નહિ.

ડી) રીમોટ ઈ-વોટીંગનો સમય રવિવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૭ ના રોજ (સવારે ૯:૦૦ થી) શરૂ થાય છે અને મંગળવાર, ૨૬ સપ્ટેમ્બ ૨૦૨૩ ના રોજ (સાંજે પ:૦૦ વાગે) પૂરો થાય છે. આ સમય દરમિયાન શેરહોલ્ડરો ક્રીઝીકલ ફોર્મ અથવા ડિમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં કટ-ઓફ તારીખે શેરો ધરાવતા હોય તેઓ રીમોટ ઈ-વોટીંગથી તેમનો વોટ આપી શકશે. ત્યારબાદ વોટીંગ માટે સીડીએસએલ દ્વારા રીમોટ ઈ-વોટીંગ મોહ્યૂલને નિરર્થક બનાવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા મત અપાઈ ગયા બાદ સભ્ય તેમાં ફેરફાર કરી શકશે નહિ.

કોઈ મુંજવણ હોય તો, સભ્યો ''ક્રિક્વન્ટલી આસ્ક્રડ ક્વેશ્વન્સ" - ''FAQS'' અને રિમોટ ઈ-વોટીંગ યુઝર મેનુઅલ https://www.evotingindia.com ના હેલ્ય સેક્શન ઉપર ઉપલબ્ધ છેતેનો ઉપયોગ કરી શકે છે. રિમોટ ઈ-વોટીંગને લગતી કોઈપણ ફરિયાદ માટે કૃપા કરીને શ્રી રાકેશ દલવી ૨ ૫મો માળ, એ વિન્ગ, મેરેથોન ફ્યુયુરેશ, મફ્તલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩, ઇમેઇલઃ <u>helpdesk.evoting@cdslindia.com</u> ક્ષેન નંબર / હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ નો સંપર્ક કરશો.

દિશમાન કાર્બોજીન એમ્સીસ લીમીટેડ

આળ : અમદાવાદ તારીખ : ૦૪/૦૯/૨૦૨૩

શ્રીમા દવે કંપની સેક્રેટરી स्थण : सरत

reli/\nce

રીલાયન્સ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડ

કોર્પોરેટ ઓફીસ : ૧૧મો માળ, ઉત્તર બાજુએ, આર-ટેક પાર્ક, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગોરેગાઁવ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૩

સિક્યોર્ડ મિલકતોના વેચાણ માટે નોટીસ (જુઓ નિયમ ૮(૬) સાથે વંચાતો નિયમ ૬(૨)) સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ

એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ–હરાજી વેચાણ નોટીસ આથી ખાસ કરીને દેવાદાર(રો) અને જામીનદાર(રો) અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર/જંગમ મિલકતો સિક્ચોર્ડ લેણદારને

ગીરો/હાયપોથીકેટેડ કરવામાં આવી હતી જેનો ભૌતિક કબજો સિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે. જે રેલીગેર હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લીમીટેડે તારીખ ૨૯.૦૩.૨૦૧૯ ના એસાઇનમેન્ટ એગ્રીમેન્ટ દ્વારા **આરએઆરસી ૦૫૯ (આરએચડીએફસીએલ** <mark>એચએલ) ટુસ્ટના દુસ્ટી રીલાયન્સ એસેટ રીકન્સ્ટુક્શન કંપની લીમીટેડ (આસ્એઆરસી</mark>) ની તરફેણમાં નીચે જણાવેલ સિક્ચોરીટીઝ સાથે તેના હકો, ટાઇટલ અને કીતો સહીત તમારા લોન એકાઉન્ટોની નાણાંકિચ મિલકતો/લેણાં સોંપ્યા છે. જ્ણાવેલ સોંપણીના આધારે અમે તમારા સિક્ચોર્ડ લેણદાર બનીએ છીએ અને સમગ્ર કરારલક્ષી બાકી રકમ વસુલવા કાનુની હકદાર છીએ.

પરિણામે, નીચે સહી કર^ળાર રીલાચન્સ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લીમીટેડના અધિકૃત અધિકારી આથી તમને ૩૦ દિવસીચ નોટીસ આપે છે કે નીચે જ્યાવેલ ગીરો મિલકતા એટલે કે "જ્યાં છે", "જે છે", અને "જેમ છે" ના ધોરણે ઇ–હરાજીના માર્ગે નીચે સહી કરનાર દ્વારા નીચે જણાવેલ દેવાદારો/ગીરવેદારો પાસેથી **આરએઆરસી ૦૫૯ (આરએચડીએફસીએલ એચએલ**) દ્રસ્ટના દ્રસ્ટી તરીકે રીલાચન્સ એસેટ રીકન્સ્ટુક્શન કંપની લીમીટેડની કલમ ૧૩(૨) હેઠળની માંગણા નોટીસમાં જણાવેલ તાકી રકમ વત્તા ચડત વ્યાજ અને ખર્ચની વસલાત માટે **૨૦.૧૦.૨૦૨૩** ના રોજ વેચવામાં આવશે. રીઝર્વ કિંમત અને અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએમડી) નીચે મુજબ છે.

ક્રમ	દેવાદારોનું નામ, મિલકતની વિગતો, માંગણા નોટીસ અને કબજાની તારીખ				
નં.	દવાદારાનું નામ, ભવકતના ાવગતા, માંગણા નાટાસ અને કળજાના તારાખ				
1	િળરળલ પ્રજાપતિ અને સુનિતાબેન પ્રજાપતિ બંનેનું સરનામું: ૩૧૧/૧, આંબેડકરનગર, ઓમકાર નગર, મેમ્કી સૈજપુર બોઘા, અમદાવાદ, ગુજરાત–૩૮૨૩૪૫, અહીં પણ : બ્લોક ચુનિટ નં. ર, ફ્લેટનં. ૩૦૨, ૩જો માળ, શ્રી ઠાકોરનાથ રેસીડેન્સી, છિકણી વાળો કુવો, ગાંધીનગર, ગુજરાત–૩૮૩૮૬૦ મિલકત : બ્લોક ચુનિટ નં. ર, ફ્લેટ નં. ૩૦૨, ત્રીજો માળ, શ્રી ઠાકોરનાથ રેસિડેન્સી, શિકનીવાળો કુવો, ગાંધીનગર, ગુજરાત–૩૮૩૮૬૦ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. (ક્ષેત્રફળ અંદાજે ૧૧૧ ચો. ચાર્ડ) માં ગણા નોટીસ : રૂ૧. ૧૪,૧૮,૮૦૧.૦૪/– (રૂપિયા ચૌદ લાખ અઢાર હજાર આઠસો એક અને ચાર પૈસા પુરા) ૦૭.૦૨.૨૦૧૮ મુજબ વત્તા ચડત વ્યાજ અને ખર્ચ.	Rs. 17,14,300/- Rs. 1,71,430/-			
2	ારેચા અતુલ ગિરિશભાઇ જે ગિરિશભાઇ રવજીભાઇ બારેચાના પુત્ર અને પુત્ર અતુલભાઇ બારેચા જે બારેચા અતુલ ગિરિશભાઇ ના પતી, બંનેનું સરનામું પ્લોટ નં. ૧૩૦, જિવાનદાસ રેસીડેન્શી, હડાલા લાલું કે ટંકાર, રાજકોટ, ગુજરાત–૩૬૦૦૦૧, અહીં પણ: રેવન્યુ સર્વ નં. ૧૬૯, જિવાનદાસ રેસીડેન્શી, પ્લોટ નં. ૪ થી ૯, ૧૪ બહીં તે છે. ૧૬૯, જિવાનદાસ રેસીડેન્શી, પ્લોટ નં. ૪ થી ૯, ૧૪ તે છે. ૧૪, અપિત એન્જિનિચરીંગ કોલેજ પાછળ, રાજકોટ, હડાલા, રાજકોટ મિલકત કરેન્યું સર્વે નં. ૧૬, ભ્રવાનદાસ રેસીડેન્શી, પ્લોટ નં. ૪ થી ૯, ૧૪, બાપ્લોટ નં. ૪ થી ૯/૧૪, હાઉસ નં. ૧૪, ભ્રસ્પીત એન્જી કોલેજ પાછળ, કોલેજ રાજકોટ, હડાલા, રાજકોટ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. (ક્ષેત્રફળ અંદાજે ૫૫–૭૮ ચો.મી.) ચતુઃસીમા : પુર્વ : રસ્તો, પશ્ચિમ : પ્લોટ નં. ૧૬, ઉત્તર : સબ પ્લોટ નં. ૪ થી ૯/૧૫ માંગશા નોટીસ : ગ્રા. ૫,૬૬,૨૦૪.૭૩/ – (રૂપિયા પાંચ લાખ છાંસઠ હજાર બસ્સો ચાર અને તીતેર પૈસા પુરા) ૦૯.૦૫.૨૦૧૮ મુજન વાતા ચડત વ્યાજ અને ખર્સ.	Rs. 6,39,750/- Rs. 63,975/-			
3	કલ્પેશ ડી. રિબડિયા જે ધિરુભાઇ મોહનભાઇ રિબડિયાના પુત્ર અને સંગીતાબેન કલ્પેશભાઇ રિબડિયા જે કલ્પેશ ડી. રિબડિયાના પત્ની તમામનું સરનામું : પ્લોટ નં. ર, માનસરોવર સોસાયટી વિભાગ ર, સરયાણા જકાતનાકા પાસે, સરયાણા સુવત, ગુજરાત નુવત, ગુજરાત, ગુજરાત નુવત કં. કલેટ નં. ૫૦૨, રત્યાન્ય શુરી રેસિડેન્શી, ઝડેશ્વર રોડ, ચામુંડા મંદિર પત, ગુજરાત (રૂગરફળ અંદાજે ૧૫૪. ૩૦ ચો.મી.) ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. યતુ:સીમા : પુર્વ : કોમન પ્લોટ, પશ્ચિમ : બિલ્ડીગં, ઉત્તર : સોસાયટી કંપાઉન્ડ દિવાલ, દક્ષિણ : ફલેટ નં. ૫૦૧ માંગણા નોટીસ : શે. 3૮,૦૪,૩૮૪.૪૦/ (રૂપિયા આડગ્રીસ લાખ ચાર હજાર ત્રણસો ચૌર્યાસી અને ચાલીસ પૈસા પુરા) ૦૯.૦૫.૨૦૧૮ મુજન વત્તા ચડત વ્યાજ અને ખર્શ.	Rs. 46,48,840/- Rs. 4,64,884/-			
4	રામકૃષ્ણા રાજેન્દ્ર ચિત્તે અને સુરેખા રાજુ નહવાણી જે રામકૃષ્ણા રાજેન્દ્ર ચિત્તે તમામનું સરનામું : ડી-૧૦૮, તુલસી ટાઉનિક્ષપ સોસાચટી, વડસર રોડ, વડોદરા, ગુજરાત-૩૯૦૧૦ અહીં પણ : ૨૦૮, બીજો માળ, દાનશ્ચામ રેસિડેન્સી, વડસર, વડોદરા, ગુજરાત-૩૯૦૦૧૦ મિલકત : ફ્લેટ નં. ૨૦૮, બીજો માળ, દાનશ્ચામ રેસિડેન્સી, વડસર, વડોદરા, ગુજરાત-૩૯૦૦૧૦ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા (ક્ષેત્રફળ અંદાજે ૫૫.૭૪ ચો.મી.) ચતુઃસીમા : પુર્વ : ફ્લેટ ં. ૨૦૭, પશ્ચિમ : ફ્લેટ નં. ૨૦૯, ઉત્તર : ોકમન પેસેજ, દક્ષિણ : લાગુ સર્વે નં. વાણી મીલકત. માંગણા નોટીસ : રૂ૫.૭,૫૭,૯૯૬.૬૫/- (રૂપિયા સાત લાખ સત્તાવન હજાર નવસો છક્યું અને પાંસઠ પૈસા પુરા) ૨૦.૧૨.૨૦૧૭ મુજબ વત્તા ચડત વ્યાજ અને ખર્ચ.	Rs. 9,86,292/- Rs. 98,629/-			
મિલકતનાં નિરિક્ષણની તારીખ : ૧૬.૧૦.૨૦૨૩ નાં રોજ બપોરે ૧૧.૦૦ થી ૦૨.૦૦ બીડ સુપરત કરવાની છેલી તારીખ : ૧૮.૧૦.૨૦૨૩ ના રોજ બપોરે ૧.૦૦ સુધી ઇ–હરાજીની તારીખ : ૨૦.૧૦.૨૦૨૩ નાં રોજ સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન, પ્રતિદિઠ ૫ મિનિટના વધારા સાથે વેચાણની શરતો અને નિયમો: ૧. મિલકત રીઝર્વ કિંમતથી ઓછી કિંમતે વેચવામાં આવશે નહી અને વેચાણ સિક્યોર્ડ ફેડીટર તરીકે આરએઆરસીની મંજુરીને આદિત્વ રહેશે. ૧. ઇ–હરાજી મેસસે સીધ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ મારફત પ્લોટ નં. ૬૮, ગુરુગીંવ, હરિયાણા બિનકોડ ૧૨૦૦૩ ખાતે ઓનલાઇન કરવામાં આવશે. ૩. ઇ–હરાજીમાં ભાગ વેતાં પહેલા, રસ ધરાવનાર બીડરો માન્ય ઇ–મેઇલ આઇડી મેળવવાનો રહેશે અને તેમનાં નામો પોર્ટલ www.bankeauctions.cm પર રજીસ્ટર કરાવીને તેમનાં યુઝર આઇડી અને પાસવર્ડ મેસર્સ સીધ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ પારોથી મેળવવાનાં રહેશે. ૪. ભાવી બીડરોને મેસર્સ સીધ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ દુશરો છે ને અને આનલાઇન તાલીમપ્રાપ્ય રહેશે. (સંપર્કર્સા વ્યક્તિઓ: શ્રી વિનોદ ચીલણ મો.: +૯૧૯૮૧૩૮૮૯૩૧, Delhર (ભાગ અથવા support@bankeauctions.com (હેવાલાઇન ના.અરલ૧૯૮૧૨૪,૨૫,૨૬) ૫. અનેરટ મની ડિપોઝીટ (ઇએમડી) ઇલેક્ટ્રીનક ફંડ ટ્રાન્સફર (આરટીજીએસ) પ્રિગેનઇએફટી) મારફત કરન્ટ એકાઉન્ટ નં.					

દ્દજરપપ૭૦૮૮, બેંકનું નામ, ઇન્ડિયન બેંક, શાખા: શાન્તાકુઝ વેસ્ટ શાખા, મુબંઇ, ૪૦૦૦૫૪ લાભાર્શીનું નામ: આરએઆરસી– ૦૫૯ (આરએચડીએફસીએલ એચએલ) ટ્રસ્ટ, આઇએફએસર્સી કોડ: IDIB000S010 પર જ્યા કરવાંની રહેશે. નોંધ લેવી કે સેક/ડિમાન્ડ ડ્રાફ્ટ ઇએમડી તરીકે સ્વીકાર્ય રહેશે નહી. **દ્ર.** રિઝર્વ કિંમતથી ઓછી શ્રુમાં તાલુક કરવા કરતા. જિમ્મતની બીડો અને/ અથવા ઇએમડી રકમ સિવાયની બીડો સ્વીકાર્ય રહેશે નહીં. બીડરો તેમની અન્ય બીડ રકમોમાં લોટ દીઠ રૂા. ૫,૦૦૦/– ના ગુણાંકમાં વધારો કરી શકે છે. હ. સકળ બીડરે સકળ બીડર તરીકેની ઘોષણા પછી તરત જબીડની રકમ/વેચાણ કિમંતનાં ર૫ ટકા ચુકવવાનાં રહેશે (અર્નેસ્ટ મની સહીત)ચુકવવાની રહેશે. સકળ બીડરે બાકીની ૭૫ ટકા બીડ/વેચાણની રકમ સફળ બીડર તરીકે ઘોષીત થયાની તારીખથી ૧૫ દિવસની અંદર જમા કરવાની રહેશે. ૮. જો સફળ બીડર ઉપર જણાવેલ વેચાણ કિમંત જ્યા કરાવવામાં નિષ્ફળ જ્શે તો, ઇએમડી સહીત તમામ જ્યા રકમ કોઇપણ નોટિસ સિવાચ જાા કરવામાં આવશે. ૯. અસફળ બીડરોની ઇએમડી રકમ ઇ હરાજી વેચાણ પ્રક્રિયાની સમાપ્તિ પછી સાત દિવસની અંદર વ્યાજ વગર પરત કરવામાં આવશે. **૧૦**. અધિકૃત અધિકારી દ્વારા અપાયેલ વિગતો તેમની શ્રેષ્ઠ જાણકારી ન્યતાઓ અને અહેવાલો અનુસાર છે. અધિકૃત અધિકારી કોઇપણ ભુલ, ખામીયુક્ત નિવેદન કે કસુર મોટે જવાબદાર રહેશે નહી. **૧૧**. નીચે સહી કરનાર અધિકૃત મધિકારી કોઇપણ પૂર્વ નોટિસ અથવા કોઇપણ કારણો જણાવ્યા વગર કોઇપણ બીડનો સ્વીકાર/અસ્વીકાર કરવાનો અથવા વેચાણ મૌકુક/મુલતવી/ રદ કરવાની અને કોઇપણ શરતો અને નિયમો ઘડવાનો હક અને સત્તા રહેશે ૧૨. બીડરો મિલકત પર ચાર્જ/ બોજા સબંધતિ પુછપરછો કરી શકે છે અને તેમી જાતને ટાઇટલ, માપન વિસ્તાર અને મિલકતની ગણવત્તા અંગે તેમની બીડ સપરત કરતાં પહેલા પોતાની જાતે સંતોષ મેળવી શકે છે. મિલકત પર ચાર્જાસ, બોજાઓ અને અન્ય કોઇપણ બાબતો વગેરે માટે કોઇપણ પ્રકારનો દાવો ઓનલાઇન બીડ સુપરત કર્ચા પછી ધ્યાનમાં લેવામાં આવશે નહી**. ૧૩**. પ્રાપ્ત અહેવાલો મુજબ નીચે સહી કરનારને આ નોટીસની તારીખે મિલક્તો પર કોઇ બોજા અંગે જાણકારી નથી. ૧૪. મિલકત પર કોઇ બોજો, બાકી રકમ, વેરા, વીએટી, ટીડીએસ, જીએસટી ચાર્જ કાનુની અથવા તે સિવાય મિલકતના વેચાણની સ્ટેમ્પ ડ્યુટી/૨જીસ્ટ્રેશન ફી ફક્ત ખરીદારે ભોગવવાની રહેશે.

ઇપણ વધુ માહિતી માટે ૧૮૦૦૧૦૩૯૭૧૧ / ૧૮૬૦૨૬૬૪૧૧૧ / ૧૮૦૦૩૦૯૯૭૧૧ નો સંપર્ક કરી શકાશે

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૬(૨), ૮(૬) અને ૯(૧) હેઠળ કાનુની ૩૦ દિવસીય નોટીસ દ્વાદારો/સહ–દેવાદારો/જામીનદારો/ગીરવેદારોને આથી ઉપર જણાવેલ ૨૬મ, તેમજ આખર તારીખ સુધીનું વ્યાજ અને આકરિમક ખર્ચ ઇ–૯રાજી પહેલા ચુકવવા જણાવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં ઉપર જણાવેલ ગીરો મિલકતની ઇ–હરાજી કરવામાં આવશે અને બાકી રકમ જો કોઇ હોચ તો, ત્યાજ/ખર્ચ સહીત વસુલવામાં આવશે. હરાજી માટે નિચત તારીખના રોજ હરાજી વેચાણ માં કોઇ બીડ ન મળવાના સંજોગોમાં. સિક્ચોર્ડ લેાગદાર ખાનગી સંધિના માર્ગે અથવા કોઇપણ ભાવી ખરીદારને ઉપરોક્ત નિયત રીઝર્વ કિંમતે આ મિલકતનું વેચાણ કરવા સ્વતંત્ર રહેશે. દેવાદાર/સહ દેવાદારો/જામીનદારો/ગીરવેદારોને આથી ગીરો મિલકતનો કબજો લેતી વખતે તૈયાર કરાયેલ પંચનામા/ ઇન્વેન્ટરી અહેવાલ મુજબ કબજો લીધેલ મેલકતમાં રહેલ કોઇપણ ઘરગથ્થુ ચીજો/ અંગત સરસામાન જો કોઇ હોય તો, આ નોટીસની તારીખ થી દૃ૦ દિવસની અંદર દુર/નિકાલ કરવા જણાવામાં ઝાવે છે. આ નોટીસની તારીખથી ૭ (સાત) દિવસના જણાવેલ ગાળા દરમિયાન ઘરગથ્થુ ચીજો/ અંગત સર સામાન દુર/નિકાલ/તબદીલ કરવામાં નેષ્ફળ જતાં, કંપનીને દેવાદાર/સહ–દેવાદારો/જામીનદારો/ગીરવેદારોના જોખમ, જવાબદારી અને ખર્સે "જ્યાં છે" "જેછે" અને "જેમ છે" ના ધોરણે તેને ખસેડવા/દુર/ નિકાલ કરવાની ફરજ પડશે. કંપની આ સબંધમાં કોઇપણ વ્યક્તિ દ્વારા ઉઠાવાયેલ કોઇપણ દાવા માટે જ્વાબદાર ગણાશે નહી. સ્થળ : ગુજરાત, તારીખ : ૦૫.૦૯.૨૦૨૩ અદિકૃત અદિકારી, રીલાયન્સ એસેટ રિકન્ટ્રક્શન કંપની લીમીટેડ

નોંધઃ સરફૈસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ જારી કર્યા પછી ભરપાઇ કરાચેલ રકમ વસુલાત/પતાવટના સમયે ચુકવવાપાત્ર બાકી રકમની ખાતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ

(CIN : L17120GJ2010PLC062949) ર**િજસ્ટર્ડ ઓફિસઃ** ળ્લોક નં. ૪૬૭, સચિન પલસાણા રોડ, પલસાણા, સુરત–૩૯૪૩૧૫ **ે ટેલિફોન** : 91 96012-81648 **dัGHAIย์ : www.rnbdenims.com • ย-พิยต : info@rnbdenims.com**

આથી આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ ના સભ્યોને ૧૩મી સામાન્ય સભાની નોટિસ આપવામાં આવે છે, જે શુક્રવાર રલ્મી સપ્ટેમ્બર , ૨૦૨૩ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે બ્લોક નં. ૪૬૭, સચિન પલસાણા રોડ, પલસાણા, સુરત–૩૯૪૩૧૫ ગુજરાત ખાતે એજીએમની નોટિસમાં જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવા માટે <u>र्ध - वोटिंग अने जुङ ङ्लोञर नोटिस</u>

કંપનીના તમામ શેર હોલ્ડેરોને જણાવવાનું કે કંપનીના સભ્યોનું રજીસ્ટર શનિવાર રરૂમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ થી શુક્રવાર ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ (બન્ને દિવસ સહીત) એજીએમના હેતુસાર બંધ રહેશે. ઇ- વોટિંગ માટે કટઑફડેટ રરમી સપ્ટેમ્બર, ર૦૨૩ તમામ સભ્યોને જણાવવાનું કે : .) એજાએમનીનોટિસની ઇલેક્ટ્રોનિક કોપી જેમના ડીપોઝિટરી પાર્ટીશિપન્સ/

અને તે જ કંપનીની વેબસાઈટ www.rnbdenims.com પર પણ મળશે. એજીએમની નોટિસની કોપી મોકલવાની કાર્યવાહી પુરી કરવામાં આવી છે. ર) જે સભ્યો ફિઝિકલ અથવા તો ડીમેટેલાઈઝડ શેર્સ કટ ઑફ ડેટ તારીખ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં ધરાવતા હોય, તેઓ એજીએમની નોટિસમાં જણાવ્યા પ્રમાણે ઇલેંક્ટ્રોનિકલી રીતે મત આપી શકશે. ઇલેક્ટોનિક મત

કંપનીમાં ઈ–મેઈલ આઈડી નોંધાચેલા છે તેમને મોક્લી આપવામાં આવ્યા છે

("રિમોટ ઈ–વોટિંગ") થી મતદાન કરી શકશે જે એજીએમની નોટિસમાં જણાવ્યા પ્રમાણે કાર્યવાહી ઇલેક્ટ્રોનિક પદ્ધિતિથી મતદાનની કામગીરી થઇ શકે છે.

આપવા માટે એનએસડીએલ મારફતે એજીએમના સ્થળ સિવાયના સ્થળેથી

રિમોટ ઈ – વોટિંગ મંગળવાર, રદ્દમી સપ્ટેમ્બર , ૨૦૨૩ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યાથી ચાલુ રહેશે.

રિમોટ ઈ – વોટિંગ ગુરુવાર, ૨૮ મી સપ્ટેમ્બર , ૨૦૨૩ના રોજ સાંજે ૦૫.૦૦ વાગે પૂર્ણ થશે.

કટ ઑફ ડેટ તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજની તારીખ સુધીમાં નોંધાચેલા સભ્યો જ ઇલેક્ટ્રોનિક અથવા તો એજીએમમાં મતદાન કરી

કંપનીની એજીએમની નોટિસની વહેંચણી થયી ગયા બાદ કોઈ વ્યક્તિએ શેર્સ કટ ઑફ ડેટ એટલે તા. ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ની તારીખ સુધીમાં ધારણ કર્યા હશે તેઓ આઈડી અને પાસવર્ડ મેળવવા માટે ઈ-મેઈલ evoting@nsdl.co.in પર વિનંતી મોકલવાથી મેળવી શકશે. તેમ છતાં કોઈ વ્યક્તિ ઈ–વોટિંગ માટે પેહલાથી એન એસડીએલમાં રેજિસ્ટર્ડ હોય

તો તેમનો આઈડી અને પાસવર્ડ મતદાન માટે ઉપયોગ કરી શકાશે. સભ્યોને જાણ કરવામાં આવે છે કે (એ) એનએસડીએલ દ્વારા ઉપર જણાવેલ તારીખ અને સમય પછી રિમોર્ટ ઇ-વોટિંગ મોડ્યુલ બંધ કરી દેવામાં આવશે અને સભ્યો દ્વારા એક વાર વોટ થઇ ગયા પછી તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહિ (બી) એજીમના સ્થળે બેલેટ પેપર દ્ધારા વોટ આપવાની પણ સુવિધા આપવામાં આવે છે (સી) જો કોઈ સભ્યે ઈ-વોટિંગના માધ્યમથી પહેલા વોટ આપી દીધો હશે તો તે એજામમાં હાજર રહી શકશે પણ કરી વોટ આપી શકશે નહીં. અને (ડી) જે વ્યક્તિનું વ્યક્તિનું નામ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા રેજિસ્ટર ઓફ બેનિફિશિયલ ઓનર્સમાં ડિપોઝિટર્સ દ્ધારા કટ ઓફ ડેટ સુધીમાં હશે ફક્ત તેમને જ રિમોટ ઈ-વોટિંગ અને એજીમના સ્થળે બેલેટ પેપરની સુવિધા

આપવામાં આવશે. ઈ-વોટિંગને લગતો કોઈપણ પ્રશ્ન હોય તો સભ્યો એનએસડીએલની વેબસાઈટ www.evoting.nsdl.com પર થી ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ ફ્રીકવનટલી આસ્ક્ડ કવેશ્વન્સ (એફએક્ચ્રુએસ) વાંચી શકે છે અથવા તો evoting@nsdl.co.in પર ઈ–મેઈલ લખી શકે છે અથવા ટોલ

ફ્રી નં. ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨૪૪૩૦ પર સંપર્ક કરી શકે છે.

ફોર,આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ સહી/-રાજકમાર બોરાના મેનેજિંગ ડિરેક્ટર તારીખ : ૦૪-૦૯-૨૦૨૩

(DIN: 01091166)

PEE CEE COSMA SOPE LTD.

CIN: L24241UP1986PLC008344

Regd. Office: Padamplaza, Hall No. H1-H2, First Floor, Plot No.5, Sec.-16B, Awas Vikas Sikandra Yojna, Agra - 07 (U.P.) Tel.: 0562-2527331/32 Fax: 0562-2527329, E-mail: info@peeceecosma.com

PUBLIC NOTICE NOTICE TO MEMBERS OF 36TH ANNUAL GENERAL MEETING,

BOOK CLOSURE AND E VOTING INFORMATION

Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Friday, 29th September, 2023 at 3:00 PM at HOTEL P.L. PALACE, SANJAY PLACE, AGRA-282002 to transact the business as

mentioned in the notice convening the Meeting.
In compliance with the relevant circulars, the Notice of AGM and the Annual Report 2022-2023 including the Financial Statements for the Financial Year 2022-23, along with the Director's Report, Auditor's Report and other documents required to be attached there to has been sent to those members whose email addresses are registered with the Company, or Depository Participants or Registrar and Share Transfer Agent. Physical copies of the Notice of 36th AGM and Annual Report has been sent to all other members at their registered address in the permitted mode. The Notice of the 36th AGM and Annual Report are also available on the Company's website www.peeceecosma.com and the website of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com. Manner of Registering/updating e-mail addresses to receive the notice of AGM

alongwith the Annual Report and for updating Bank Account Mandate for receip

Members holding shares in physical mode are requested to update their email addresses by sending a request letter to the company at pccosmalisting@doctorsoap.com alongwith the Form ISR 1 mentioning the name, Folio no., Mobile no., email address and address of the shareholder, bank account details, cancelled cheque leaf, scanned copies of share certificate(s) (both sides), self-attested PAN card and self attested copy of any document (eg. Driving License, Election Identity Card, Passport, Aadhar Card) in support of the address of the shareholder.

Members holding shares in Dematerialised mode are requested to register/update their email addresses, Mobile Numbers, Bank Account details for receipt of

dividend, and/or other details with the relevant Depository Participan Voting: Pursuant to Section 108 of the Companies Act 2013 and Rule 20 of The Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is pleased to provide e-voting facility to its Members enabling them to cast their vote for all the resolutions as set in the Annual General Meeting Notice. The Company has availe e-voting services as provided by National Securities Depository Limited (NSDL). Shri Debabrata Deb Nath, Company Secretary in whole-time Practice of M/s R & D Company Secretaries, Delhi, has been appointed as the Scrutinizer for conducting e-voting process in a fair and transparent manner. The e-voting period commence sday, 26th September, 2023 at 9:00 am IST and ends on Thursday September, 2023 at 5:00 pm IST. The e-voting module shall be NSDL, for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. The voting rights of Members shall be as per the Number of Equity shares held by them as on the cut-off date which is 22nd September, 2023. Any person, who becomes member of the company after sending the notice of the 36th AGM by email and holding shares as on the cut-off date e 22nd September 2023, may obtain the login ID and password by sending a request

as zero dependence of the control of Members may note that (1) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (2). At the venue of AGM, voting shall be done through ballot papers ("Ballot Paper") and the Members attending AGM who have not casted their vote by Remote E-voting shall be entitled to cast their vote through Ballot Paper. Member may participate in the AGM even after exercising his right to vote through Remote E-voting but shall not be allowed to vote again at the venue of the AGM. If a Member casts votes through Remote E-voting and also at the AGM, then voting done through Remote E-voting shall prevai and voting done at the AGM shall be treated as invalid.

Book Closure: Pursuant to the provision of section 91 of the Companies Act 2013 and rules made there under, and Regulation 42 of SEBI (Listing Obligations and Discl Requirements) Regulations 2015, the Register of Members and Share Tra book of the Company will remain closed from Friday, 22nd September 2023 to Friday, 29th September, 2023 (both days inclusive) for the purpose of Dividend and 36th Annual General Meeting to be held on Friday, 29th September, 2023.

Dividend: Shareholders may note that the Board of Directors at their meeting held or 27th May 2023, has recommended a final dividend of Rs. 2/- per share. The Final dividend, subject to approval of shareholders, will be paid to the members whose names appear in the Register of members as on the cut off date i.e. Friday, 22nd September, 2023 through various online transfer modes to the shareholders who have updated their bank account details. For shareholders who have not updated their bank account details, dividend warrants/DD/Cheque will be sent to the Registered addres

pending on availability of postal services. Manner of registering mandate of receiving dividend electronically To avoid delay in receiving dividend, Members are requested to update their ban

details with their Depositories (where the shares are held in dematerialized mode) and with Company/RTA -Skyline Financial Services Ltd., (where the shares are held in ohysical mode) by sending scanned copy of signed request letter mentioning the name, folio no., bank account details, self attested copy of PAN card and a cancelled cheque leaf with pre printed name of the member (first shareholder) o the Company through email oninfo@skylinerta.com or info@peeceecosma.com Shareholders may note that the Income Tax Act, 1961 (ACT), as amended by the Finance Act, 2020, mandates that dividend paid or distributed by a company afte 1st April, 2020 shall be taxable in the hands of the shareholders. The Company shall ore be required to deduct Tax at Source (TDS) at the time of making of the fina vidend. In order to enable us to determine the applicable TDS rates, shareholders are equested to submit the documents in accordance with the provisions of the Act. The etailed tax rates and documents required for availing the applicable tax rates an

Shareholders holding shares in the physical form are required to convert their holding in DEMAT form as transfer of shares in physical form has b

The entry to the meeting venue will be regulated by Attendance Slips, which have bee sent along with Annual Report to the Members. Members are requested to submit a

vided in the notice of the A.G.M.

duly filled in Attendance Slip at the registration counter to attend the AGM. In case of any queries related to E-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll at the download section of www.evoting.nsdl.com or call on to 1800-222-990 or send a request at evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager or Ms. Soni Singh, Asst. Manager, National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013, at evoting@nsdl.co.in or allavid@nsdl.co.in or SoniS@nsdl.co.in or at telephone nos.:- +91 22 24994545 +91 22 24994559, who will also address the grievances connected with the voting by

> For & on behalf of the Board PEE CEE COSMA SOPE LIMITED (Executive Chairman) DIN: 00112947

DATED: 05.09.2023